

# ધી માણસા નાગરિક સહકારી બેંક લિ.

સ્થાપના તા. ૯-૯-૧૯૭૩

રજી નં. ૧૨૧૭૫

Licence No. : UBD. GJ. 505 P

માણસા (ઉ.ગુ.)



“ભચતરૂપી ઘોડ વાવો”



૪૮ મો

વાર્ષિક અહેવાલ  
૨૦૨૦-૨૦૨૧

ઓડિટ વર્ગ-અ



# ઘી માણસા નાગરિક સહકારી બેંક લિ.

## બોર્ડ ઓફ ડિરેક્ટર્સ



શ્રી ગોવિંદલાલ એ. પટેલ  
ચેરમેન



શ્રી કનુલાલ એચ.પટેલ  
વાઈસ ચેરમેન



શ્રી અમૃતલાલ એસ. પટેલ  
ડિરેક્ટર




શ્રી જયંતિલાલ એ. પટેલ  
ડિરેક્ટર



શ્રી ભરતલાલ જે. ચૌધરી  
ડિરેક્ટર



શ્રી અનિલકુમાર એ. પટેલ  
ડિરેક્ટર



શ્રી મહેન્દ્રલાલ આર. પંચાલ  
ડિરેક્ટર



શ્રી રામાલાલ ટી. પટેલ  
ડિરેક્ટર



શ્રી લીખાલાલ કે. પટેલ  
ડિરેક્ટર



શ્રી મહેન્દ્રલાલ કે. પટેલ  
ડિરેક્ટર



શ્રીમતી ગોમતીબેન ની. પટેલ  
ડિરેક્ટર



સુશ્રી મંજુલાબેન કે. પ્રજાપતિ  
ડિરેક્ટર



શ્રી નરેન્દ્રકુમાર કે. પરમાર  
ડિરેક્ટર



શ્રી મણીલાલ જે. પટેલ  
કો. ઓ. ડિરેક્ટર



શ્રી દિલીપલાલ પી. પટેલ  
કો. ઓ. ડિરેક્ટર



શ્રી હાર્દિક આર. પટેલ  
પ્રોફે. ડિરેક્ટર



શ્રી કમલેશકુમાર જે. શાહ  
M.D./C.E.O.

# The Mansa Nagarik Sahakari Bank Ltd. Mansa

## ઘી માણસા નાગરિક સહકારી બેન્ક લિ. માણસા

રજિસ્ટર્ડ નંબર	: - સે/ ૧૨૧૭૫
સ્થાપના	: - ૦૯-૦૯-૧૯૭૩
રિઝર્વ બેન્ક લાયસન્સ નંબર	: - UBD.GUJ.505P
રજિસ્ટર્ડ અને મુખ્ય કચેરી (Head Office)	: - જૂના ગંજ બજાર, માર્કેટ યાર્ડ, માણસા જિ. ગાંધીનગર ૩૮૨૮૪૫.
ફોન નંબર	: - (૦૨૭૬૩) ૨૭૦૩૦૪, ૨૭૦૭૩૬, ૨૭૪૩૫૮ ફેક્સ ૨૭૦૪૦૩
વેબ સાઈટ	: - www.mnsbl.com
ઈમેલ	: - mansabank@yahoo.co.in, info@mnsbl.com
પાન નંબર	: - AAAAT2501Q
જી.એસ. ટી. નં.	: - 24AAAAT2501Q1ZI
St. Reg. No.	: - AAAAT2501QST001
TAN No.	: - AHMT 00915F
શાખા :- ૦૧. માર્કેટ યાર્ડ શાખા, માણસા	: - જૂના ગંજ બજાર, માર્કેટ યાર્ડ, માણસા જિ. ગાંધીનગર ૩૮૨ ૮૪૫ ફોન નં. (૦૨૭૬૩) ૨૭૦૩૦૪, ૨૭૪૩૫૮ IFS Code : YESBOTMNS01
શાખા :- ૦૨. બજાર શાખા, માણસા	: - બજાર, માણસા જિ. ગાંધીનગર ૩૮૨ ૮૪૫ ફોન નં. (૦૨૭૬૩) ૨૭૦૦૩૪ IFS Code : YESBOTMNS02
શાખા :- ૦૩. શાહીબાગ શાખા, અમદાવાદ	: - પહેલો માળ, શ્રીન કોમ્પ્લેક્સ, રાજસ્થાન હોસ્પિટલ સામે, શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪ ફોન નં. (૦૭૯) ૨૨૮૬૦૭૬૫ IFS Code : YESBOTMNS03
શાખા :- ૦૪. ગાંધીનગર શાખા	: - પહેલો માળ, પર ૧/૨, સેક્ટર-૨૨, ઘ-૬, ગાંધીનગર, ૩૮૨૦૨૨ ફોન નં. (૦૭૯) ૨૩૨૨૦૦૫૪ IFS Code : YESBOTMNS04
શાખા :- ૦૫. નિકોલ શાખા, અમદાવાદ	: - ૪૫-૪૬, સૌંદર્ય વિલા શોપિંગ સેન્ટર, શુકન બંગ્લોઝ સામે, શુકન કોસ રોડ, નિકોલ, અમદાવાદ ૩૮૨૩૫૦ ફોન નં. (૦૭૯) ૨૨૯૮૧૦૦૫ IFS Code : YESBOTMNS05

### ઓડિટ વર્ગ - “અ”

બેન્કર્સ	હોદ્દેદારો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા	શ્રી ગોવિંદભાઈ અંબાલાલ પટેલ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા	શ્રી કનુભાઈ હરગોવનદાસ પટેલ
બેન્ક ઓફ બરોડા	શ્રી કમલેશકુમાર જયંતિલાલ શાહ
આઈ.ડી.બી.આઈ. (IDBI) બેન્ક	
કોર્પોરેશન બેન્ક	
ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેન્ક લિ.	મં. ઉર્વીશ પટેલ એન્ડ કંપની
ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેન્ક લિ.	શ્રી ઉર્વીશ રતિલાલ પટેલ (C.A.)
ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેન્ક લિ.	૧૨, શાંતિનિકેતન, સ્ટેશન રોડ, ખેરાલુ ૩૮૪ ૩૨૫
એચ.ડી.એફ.સી. બેન્ક (HDFC)	ગુજરાત
યશ બેન્ક	પેનલ નંબર :- 79
આઈ.સી.આઈ.સી. આઈ. બેન્ક	મેમ્બરશીપ નંબર :- 115833
એક્સીસ બેન્ક	FRN :- 124710W
ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓપ. બેન્ક લિ.	E-Mail :- urvishpatelandco@gmail.com
ધી મહેસાણા અર્બન કો.ઓપ. બેન્ક લિ.	મો.નંબર. :- +91-99250 35856
	ફોન નંબર. :- +91-079-48961100

**-: Devotion to work is the reputation of the organization :-**

## બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

શ્રી	ગોવિંદભાઈ અંબાલાલ પટેલ	ચેરમેન શ્રી
શ્રી	કનુભાઈ હરગોવનદાસ પટેલ	વાઈસ ચેરમેન શ્રી
શ્રી	અમૃતભાઈ સોમાભાઈ પટેલ	ડિરેક્ટર શ્રી
શ્રી	જયંતિભાઈ અંબાલાલ પટેલ	”
શ્રી	ભરતભાઈ જીવણલાલ ચૌધરી	”
શ્રી	અનિલભાઈ અંબાલાલ પટેલ	”
શ્રી	મહેન્દ્રભાઈ કાન્તિલાલ પટેલ	”
શ્રી	રામાભાઈ ત્રિભોવનદાસ પટેલ	”
શ્રી	ભીખાભાઈ કચરાલાલ પટેલ (બી.કે.પટેલ)	”
શ્રી	મહેન્દ્રભાઈ રમણલાલ પંચાલ	”
શ્રીમતી	ગોમતીબેન ભીખાલાલ પટેલ	મહિલા ડિરેક્ટર શ્રી
સુશ્રી	મંજુલાબેન કાળીદાસ પ્રજાપતિ	”
શ્રી	નરેન્દ્રકુમાર કાન્તિલાલ પરમાર	અનુ.જ.જા. ડિરેક્ટર શ્રી
શ્રી	મણીભાઈ જીવરામદાસ પટેલ	કો-ઓપ્ટ ડિરેક્ટર શ્રી
શ્રી	દિલીપભાઈ પ્રહલાદભાઈ પટેલ	કો-ઓપ્ટ ડિરેક્ટર શ્રી
શ્રી	હાર્દિક રમણભાઈ પટેલ (C. A.)	પ્રોફે. ડિરેક્ટર શ્રી

શ્રી કમલેશ જયંતિલાલ શાહ [M.D./C.E.O/G.M.]

## બેંકની નાણાંકીય પરિસ્થિતિ પ્રથમ નજરે (તા. ૩૧.૦૩.૨૦૨૧)

સભાસદ સંખ્યા :- ૬૮૮૦			
		(૨૬૫ ₹ લાખમાં)	
અધિકૃત શેર ભંડોળ	₹ ૧૦૦૦.૦૦	વર્કિંગ કેપિટલ	₹ ૨૨૦૩૭.૮૯
ભરપાઈ થયેલ શેર ભંડોળ	₹ ૬૫૨.૭૫	થાપણો	₹ ૧૮૦૬૪.૫૧
રિઝર્વ અને અન્ય ફંડ	₹ ૨૨૮૭.૩૮	ધિરાણો	₹ ૯૬૭૬.૩૦
ઓવરશ્યુ ઈન્ટરેસ્ટ રિઝર્વ	₹ ૫૬.૦૧	નફો	₹ ૨૩૭.૦૦
<ul style="list-style-type: none"> <li>➤ ગ્રોસ એન.પી.એ. (NPA) ₹ ૩૪૫.૦૪ કુલ ધિરાણના ૩.૫૭% છે.</li> <li>➤ નેટ એન.પી.એ. (NPA) ૦.૦૦% છે.</li> <li>➤ CRAR ૧૬.૮૧%</li> <li>➤ CDR(સી.ડી.રેશીયો) ૫૦.૭૬% છે.</li> </ul>			

## ૪૮મી વાર્ષિક સાધારણ સભાની નોટિસ

આથી ધી માણસા નાગરિક સહકારી બેન્ક લિ.ના સર્વે સભાસદો, પ્રતિનિધિ સભાસદો અને નિમંત્રીતોને જાણ કરવામાં આવે છે કે ધી માણસા નાગરિક સહકારી બેન્ક લિ.ની ૪૮મી વાર્ષિક સાધારણ સભા તા.૨૫-૦૮-૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૦૯.૩૦ કલાકે “શ્રી ૪૧ ગામ કડવા પાટીદાર સમાજની વાડી, રીટ્રોલ રોડ, માણસા-૩૮૨૮૪૫ જિ. ગાંધીનગર” મુકામે નીચે જણાવ્યા પ્રમાણેના કામકાજ સારૂ મળશે, તો દરેક સભાસદે સમયસર સભાના સ્થળે હાજરી આપવા વિનંતી છે.

**ખાસ નોંધ:-** કોવિડ-૧૯ (Covid-19) અંગેના લોકલ ઓથોરીટી, અર્ધ-સરકારી તેમજ સરકારી કચેરીઓના તમામ માર્ગદર્શિકા અને આદેશોનું સંપૂર્ણ પાલન દરેક વ્યક્તિએ કરવાનું રહેશે. ગુજરાત સરકારશ્રીની હાલની માર્ગદર્શિકા અને આદેશો મુજબ સભાસદોની વ્યક્તિગત ઉપસ્થિતિ ૪૦૦ સુધી મર્યાદિત/સીમિત રાખવામાં આવેલ છે, જે વહેલા તે પહેલાના ધોરણે ગણવામાં આવશે. સભાસદોની વ્યક્તિગત ઉપસ્થિતિ મર્યાદિત/સીમિત સંખ્યાથી વધુને સભામાં પ્રવેશ આપવામાં નહિ આવે. સભામાં પ્રવેશ આપતા પહેલા તમામ સભાસદો, પ્રતિનિધિ સભાસદો અને નિમંત્રીતોનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કર્યા પછી જ નોર્મલ ટેમ્પરેચર વાળી વ્યક્તિને જ સભામાં પ્રવેશ આપવા દેવામાં આવશે, બિમાર અથવા નાતંદુરસ્ત વ્યક્તિને સભામાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ અને સભામાં પ્રવેશ કરતાં પહેલાં હેન્ડવોશ/સેનીટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે, દરેક વ્યક્તિએ સભામાં માસ્ક/રૂમાલ અથવા ફેશ કવર ફરજિયાત પહેરીને આવવાનું રહેશે અને સભાના કામકાજ દરમ્યાન પણ પહેરવાનું રહેશે, સભાના કામકાજ દરમ્યાન એક મીટર/પર્યાપ્ત/બે ગજ જેટલું અંતર/સોશિયલ ડિસ્ટન્સીંગ દરેક વ્યક્તિએ જાળવવાનું/પાલન કરવાનું રહેશે.

**આ મહામારીના કારણોસર ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ નથી.**

### કાર્યસૂચિ / એજન્ડા

- તા.૦૭-૦૩-૨૦૨૧ને રવિવારના રોજ મળેલ ૪૭મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વાંચનમાં લઈ બહાલી આપવા બાબત.
- તા.૩૧-૦૩-૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટે બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી તૈયાર કરવામાં આવેલ સને ૨૦૨૦-૨૦૨૧ના વર્ષના કામકાજનો અહેવાલ, બેન્કનું ઓડિટેડ સરવૈયું, નફા-નુકશાન ખાતું, નફાની ફાળવણી, ડિવિડન્ડની વહેંચણી મંજૂર કરવા બાબત.
- સને ૨૦૨૦-૨૦૨૧ના વર્ષનો ઓડિટ રીપોર્ટ વાંચનમાં લઈ નોંધ લેવા બાબત.
- સને ૨૦૨૧-૨૦૨૨ના વર્ષ માટે બેન્કના હિસાબો તપાસવા ભારતીય રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડિટરશ્રીની નિમણૂકને બહાલ આપી તથા તેમનું મહેનતાણું નક્કી કરવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સત્તા આપવા બાબત.
- સને ૨૦૨૧-૨૦૨૨ના વર્ષ માટે બહારના દેવાની હદ નક્કી કરવા બાબત.
- મંજૂર થઈ આવેલ પેટા નિયમની નોંધ લેવા બાબત.
- બેન્કના ઉદ્દેશો પ્રમાણે કામકાજ કરવા વ્યવસ્થાપક કમિટીને અધિકાર આપવા તથા વહીવટી નિયમોને બહાલી આપવા બાબત.
- ચેરમેનશ્રીની સંમતિથી અન્ય કંઈ રજૂ થાય તે કામો બાબત.

સ્થળ :- માણસા

તારીખ :- ૨૪/૦૮/૨૦૨૧

બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી

શ્રી કમલેશ જે. શાહ

M.D./C.E.O./G.M.

### \* નોંધ:-

- કોરમના અભાવે વાર્ષિક સાધારણ સભા મુલતવી રહેશે તો, તે જ દિવસે અને તેજ સ્થળે અડધા કલાક બાદ કાર્યસૂચિ મુજબના કામકાજ કરવા મળશે અને તેટલાં સભાસદોનું કોરમ ગણી સભાનું કામકાજ પૂરું કરવામાં આવશે.
- આપ વાર્ષિક સાધારણ સભામાં આવો ત્યારે આપનું સભાસદ ઓળખપત્ર ફરજિયાત સાથે લાવવા વિનંતી છે. સભાસદ સિવાયની વ્યક્તિને વાર્ષિક સાધારણ સભામાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ, તેમજ સભામાં અહેવાલની બીજી નકલ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે નહિ તેની ખાસ નોંધ લેવા વિનંતી.
- વાર્ષિક અહેવાલની નકલ ન મળી હોય તે મેળવવા ઈચ્છુક સભાસદોએ બેન્કની મુખ્ય કચેરીમાં સંપર્ક કરી મેળવી લેવા વિનંતી છે. જો કોઈ સભાસદશ્રીને સરવૈયા તથા નફા-નુકશાનના હિસાબો અંગે વધુ માહિતી જોઈતી હોય તો વાર્ષિક સામાન્ય સભાની તારીખથી સાત દિવસ અગાઉ તા. ૨૬-૦૨-૨૦૨૧ પહેલાં બેન્કની મુખ્ય કચેરીમાં લેખિત માંગણી મોકલી આપવા વિનંતી છે. જેથી માંગણીની શક્ય વિગતો રજૂ કરી શકાય.
- ભારતીય રિઝર્વ બેન્કના આદેશ અનુસાર દરેક સભાસદના KYC સંબંધિત પુરાવા લેવાનું ફરજિયાત થયેલ હોવાથી જે સભાદાઓએ KYC સંબંધિત પુરાવાઓ પૂરા નહિ પાડ્યા હોય, તેમણે આવા પુરાવા પૂરા પાડ્યા બાદ જ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
- જે સભાસદો/ગ્રાહકોએ હજી સુધી તેમના વારસદારોની નિમણૂક ન કરી હોય તેમને વારસદારોની નિમણૂક કરવા વિનંતી છે.

## ચેરમેનશ્રીનું નિવેદન.....

### માનનીય સભાસદ ભાઈઓ અને બહેનો,

આપણી બેન્કની ૪૮મી વાર્ષિક સાધારણ સભામાં આપ સર્વનું આપણી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી સ્વાગત અને અભિવાદન કરતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. છેલ્લાં ૪૮વર્ષથી ગુજરાત રાજ્યના સામાન્ય માનવીને આપણી બેન્ક બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે.

તા.૩૧-૦૩-૨૦૨૧ના રોજ પૂરા થયેલ નાણાકીય વર્ષના ઓડિટ થયેલ હિસાબો, સરવૈયા, નફા-નુકશાન ખાતું અને માહિતી વ્યવસ્થાપક સમિતિએ મંજૂર કરેલ અને આ સભાની મંજૂરી માટે ભલામણ કરેલ તે વ્યવસ્થાપક સમિતિ વતી હું આપશ્રી સમક્ષ મંજૂરી માટે અત્રે રજૂ કરું છું.

### શેર ભંડોળ

સને ૨૦૧૯-૨૦૨૦ના વર્ષનું શેર ભંડોળ ₹ ૬૩૧.૨૯ લાખ અને સભાસદોની સંખ્યા ૭૦૨૩ હતી. જે સને ૨૦૨૦-૨૦૨૧ના વર્ષનું શેર ભંડોળ ₹ ૬૫૨.૭૫ લાખ અને સભાસદોની સંખ્યા ૬૯૮૦ થયેલ છે. આમ વર્ષ દરમ્યાન શેર ભંડોળમાં ₹ ૨૧.૪૬ લાખનો વધારો થયેલ છે.

### રિઝર્વ તથા અન્ય ભંડોળ

બેન્કની સધ્ધરતાનો આધાર તેના પોતાના ફંડો છે. જેમાં સને ૨૦૧૯-૨૦૨૦ના વર્ષના અંતે કુલ રિઝર્વ અને અન્ય ફંડો ₹ ૨૦૮૯.૦૮ લાખના હતાં. જે સને ૨૦૨૦-૨૦૨૧ના વર્ષના અંતે કુલ રિઝર્વ અને અન્ય ફંડો ₹ ૨૨૮૭.૩૮ લાખના થયેલ છે. આમ વર્ષ દરમ્યાન ₹ ૧૯૮.૩૦ લાખનો વધારો થયેલ છે.

### થાપણો તથા ડી.આઈ.સી.જી.સી. પ્રિમીયમ

બેન્કના હૃદયસમી બેન્કની થાપણો સને ૨૦૧૯-૨૦૨૦ વર્ષ દરમ્યાન કુલ ₹ ૧૬૫૪૫.૩૭ લાખની હતી. જે સને ૨૦૨૦-૨૦૨૧ના વર્ષના અંતે કુલ થાપણો ₹ ૧૯૦૬૪.૫૮ લાખની થયેલ છે. આમ વર્ષ દરમ્યાન થાપણોમાં ₹ ૨૫૧૯.૨૧ લાખનો વધારો થયેલ છે.

કાયદાકીય જરૂરીયાત અને થાપણદારોના હિતમાં ₹ ૫.૦૦ લાખ સુધીની થાપણો સુરક્ષિત કરવા બેન્કે જરૂરી પ્રિમીયમની રકમ જી.એસ. ટી. સહિત સમયસર ભરપાઈ કરેલ છે.

### રોકાણો

અહેવાલના વર્ષ દરમ્યાન બેન્ક ગર્વમેન્ટ સિક્યુરિટીઝમાં (સરકારી જામીનગીરીમાં), પી.એસ.યુ. (CRB) અને અન્ય સંસ્થાના શેરમાં કુલ ₹ ૬૬૭૮.૪૦ લાખ (ફેસ વેલ્યુ)નું રોકાણ કરેલ છે. વિવિધ બેન્કો તથા MNCB (₹ ૬૯૯.૮૧ લાખ) સહિત ₹ ૫૨૦૦.૫૯ લાખનું બાંધી મુદત થાપણો તથા ચાલુ ખાતામાં રોકાણ કરેલ છે. ઉપરોક્ત તમામ રોકાણો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યની સૂચના મુજબ જ કરવામાં આવેલ છે.

તેમજ બેન્કની મિલકતોમાં જમીન-મકાન, રિવેલ્યુએશન રિઝર્વ(₹ ૩૪.૮૦ લાખ) સહિત ₹ ૭૭.૩૧ લાખ છે. ડેડસ્ટોક, ફર્નિચર, જડતર અને અન્ય ₹ ૫૩.૮૧ લાખ, વાહન ₹ ૧૨.૩૭ લાખ છે.

### ધિરાણ

બેન્કની થાપણો જેટલું જ મહત્વ ધિરાણોનું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યના આદેશો, બેન્કનું હિત અને બેન્કના સભાસદો/ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શક્ય હોય તેટલાં વ્યવહારુ બનીને તથા સભાસદો/ગ્રાહકોના ઉત્કર્ષ અને ઉચ્ચતર જીવન સાથે બેન્ક પણ પ્રગતિના નવા સોપાન સર કરી શકે તે માટે બેન્કનું સંચાલક મંડળ સતત પ્રયત્નશીલ રહે છે. સને ૨૦૧૯-૨૦૨૦નું કુલ ધિરાણ ₹ ૮૭૫૫.૯૫ લાખ હતું, જે સને ૨૦૨૦-૨૦૨૧માં કુલ ધિરાણ ₹ ૯૬૭૬.૩૦ લાખનું થયેલ છે. આમ વર્ષ દરમ્યાન ધિરાણમાં ₹ ૭૯.૬૫ લાખનો ઘટાડો થયેલ છે.

### બેન્કના ડિરેક્ટર્સને ધિરાણ

ડિરેક્ટર્સના કોઈ સગા સંબંધીઓને કે તેમની પેઢીઓને કે જેમાં તેઓનું હિત સમાયેલું હોય તેવું કોઈ જ પ્રકારનું ધિરાણ કરેલ નથી. તેમજ ફંડનું રોકાણ હોય તેવા પ્રકારનું ધિરાણ કરેલ નથી.

### વસુલાત તથા એન.પી.એ.

બેન્કનો વસુલાત માટેના પ્રયત્નો અભિગમ હંમેશા વ્યવહારુ રહેલ છે. બેન્કે કરેલ ધિરાણ સમયસર પરત આવે અને એન.પી.એ. ના થાય તે માટે બેન્કનું સંચાલક મંડળ તથા બેન્કના તમામ કર્મચારીગણ હર હંમેશ પ્રયત્નશીલ રહે છે. સને ૨૦૨૦-૨૦૨૧નું ગ્રોસ એન.પી.એ. ₹ ૩૪૫.૦૧ છે, જે કુલ ધિરાણના ૩.૫૭% થાય છે, અને નેટ એન.પી.એ. ₹ ૦.૦૦ છે, જે કુલ ધિરાણના ૦.૦૦% થાય છે.

### ઓડિટ અને ઈન્સ્પેક્શન

તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજ પૂરા થયેલ વર્ષ આખરના બેન્કના વાર્ષિક હિસાબો રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય તરફથી અધિકૃત કરવામાં આવેલ પેનલ ઉપરના ઓડિટર મેં. ઉર્વાશ પટેલ એન્ડ કંપની ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરવામાં આવેલ છે. અને બેન્કનો ઓડિટ વર્ગ “અ” ચાલુ રાખવામાં આવેલ છે. તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આદેશ અને માર્ગદર્શન મુજબ બેન્કનું તમામ શાખાઓ સહિત “કોન્કરન્ટ ઓડિટ” મેં. ગોવિંદ આર પટેલ એન્ડ કું. ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરવામાં આવેલ છે, જેના માસિક ઓડિટ રિપોર્ટ તેમજ સ્ટેટ્યુટરી ઓડિટ રિપોર્ટ અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈન્સ્પેક્શન રિપોર્ટ ઓડિટ કમિટી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટીંગ સમક્ષ રજૂ કરી, ખામીઓ દુરસ્ત કરી સુધારાના સૂચનોનો બેન્ક દ્વારા અમલ કરવામાં આવેલ છે.

### વિમા વિભાગની સારાહનીય કામગીરી

આપણી બેન્કના સભાસદો અને ગ્રાહકોને એક જ સ્થળેથી તમામ પ્રકારની વિમાની સેવાઓ મળી રહે તે માટે બેન્કનો “વિમા સેવા વિભાગ” કાર્યરત છે. જીવન વિમો તથા જનરલ વિમા અંગે વિવિધ વિમા કંપનીઓ સાથે મળી એકજ સ્થળે વિમા સેવા સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ વડાપ્રધાન સુરક્ષા અને વડાપ્રધાન જીવન જ્યોત વિમા યોજનામાં આપણી બેન્કનું કાર્ય નોંધનીય રહેલ છે.

બેન્ક તમામ સભાસદોને ₹ ૩.૦૦ લાખના અકસ્માત વિમાનું કવચ ગુજરાત રાજ્યમાં ખૂબજ નજીવા પ્રિમીયમ દરથી અકસ્માતના જોખમને કવર કરવામાં આવે છે. મિત્રો, વિમા પ્રિમીયમ લેવું તે માત્ર આપણી બેન્કનો હેતુ નથી પરંતુ વિમા ગ્રાહકોના કલેઈમ અંગેની તમામ કામગીરી ખૂબજ કાળજી અને ચીવટપૂર્વક આપણી બેન્ક દ્વારા કરી આપવામાં આવે છે. તે બદલ વિમા સેવા વિભાગની ટીમને અભિનંદન પાઠવું છું.

### **આધુનિક ટેકનોલોજી સાથે બેન્કિંગ સેવા અને શાખા વિકાસ**

હાલમાં બેન્કિંગ ક્ષેત્રે ડિજીટલ અને નવી ટેકનોલોજી અને વિવિધ સેવાઓ આવી રહી છે. નવા સોફ્ટવેરમાં તમામ ખાતેદારોને તેમના ખાતા નંબર ૧૫(પંદર) ઓંકડાના થયા છે. જે આવનાર સમય માટે જરૂરી છે. આપણી બેન્કમાં વિવિધ ડિજીટલ સુવિધા ટૂંક જ સમયમાં ચાલુ કરવામાં આવશે. આપણી બેન્કની તમામ શાખાઓ અદ્યતન સગવડભરી સુવિધાઓથી સજ્જ છે. અને તમામ શાખાઓનું તમામ કામકાજ કાળજી અને ચોકસાઈ પૂર્વક કરવામાં આવે છે.

### **નફાની ફાળવણી અને ડિવિડન્ડ**

તા. ૩૧-૦૩-૨૦૨૧ના વર્ષાન્તે બેન્કે જરૂરી પ્રોવિઝનો અને જોગવાઈઓ કર્યા બાદ ₹૨૩૭.૦૦ લાખનો વહેંચણી પાત્ર ચોખ્ખો નફો કરેલ છે. બેન્કનું સંચાલક મંડળ બેન્કના પેટા કાયદા મુજબ નીચે જણાવ્યા પ્રમાણે ચોખ્ખા નફાની ફાળવણી કરવા તેમજ મંજૂર કરવા ભલામણ કરે છે. ચાલુ વર્ષે કાયદા પ્રમાણે ડૂબત શકમંદ લહેણાં જોગવાઈ તેમજ બેન્કની સધ્ધરતા વધારવાના ઈરાદા સાથે ઘણી જોગવાઈઓ બેન્ક દ્વારા કરવામાં આવેલ છે. તેમ છતાં સભાસદોને વર્તમાન કાયદા તથા પેટા કાયદાની જોગવાઈમાં રહીને ચાલુ વર્ષે ડિવિડન્ડ ૧૨ % લેખે ચૂકવવાનું કુલ ડિવિડન્ડ ₹ ૭૮,૩૫,૦૦૦/- આપવાની ભલામણ બેન્કના સંચાલક મંડળે કરેલ છે. જે ચાલુ વર્ષેના નફામાંથી ચૂકવવા પેટા કાયદા મુજબ આપશ્રીને મંજૂર કરવા બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી ભલામણ કરવામાં આવે છે.

ચોખ્ખા નફાની ફાળવણી ૩૧-૦૩-૨૦૨૧		રકમ રૂપિયા
તા. ૩૧.૦૩.૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો		2,37,00,000.00
રિઝર્વ ફંડ	25.00 %	59,25,000.00
ખરાબ લેણાં સામે અનામત ફંડ	15.00 %	35,55,000.00
	<b>બાકી</b>	<b>1,42,20,000.00</b>
સૂચિત ડિવિડન્ડ	12.00 %	78,35,000.00
ડિવિડન્ડ ઇન્કિવલાઈઝેશન ફંડ (ભરપાઈ થયેલ શેર ભંડોળ ₹ 6,31,29,250/- નાં 2%)	2.00 %	13,05,500.00
શિક્ષણ ફાળો (મહત્તમ ₹ 2.00 લાખ)	2.50 %	2,00,000.00
આઈ. એફ . આર.		42,39,500.00
બિલ્ડીંગ ફંડ	40.00 %	3,20,000.00
સભાસદ કલ્યાણ નિધિ	20.00 %	1,60,000.00
ધર્માદા ફંડ	10.00 %	80,000.00
સહકાર પ્રચાર	10.00 %	80,000.00

### **શ્રદ્ધાસુમન/શ્રદ્ધાંજલિ**

આપણી બેન્કના વર્ષ દરમ્યાન જે સભાસદો, ખાતેદારો અને ગ્રાહકો અવસાન પામેલ છે, તેની નોંધ લઈ બેન્કનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેઓના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિરશાંતિ અર્પે તેમજ તેમના આત્મીયજનોને તેઓ ઉપર આવેલ આફત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે. **ૐ શાંતિ ૐ.....**

### **આભાર દર્શન**

બેન્કના સંચાલન અને વિકાસની કામગીરીમાં મારા સહભાગી મેનેજીંગ ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સાથી મિત્રો, શાખ સમિતિ તથા અન્ય સમિતિના સભ્યશ્રીઓ તેમજ સર્વે સભાસદશ્રીઓ, થાપણદારો, ગ્રાહકો તથા શુભેચ્છકોએ વર્ષ દરમ્યાન આપેલ સાથ અને સહકારની નોંધ લઈ સર્વેનો આભાર માનું છું.

બેન્કના કામકાજમાં રિઝર્વ બેન્કના અધિકારીઓ, રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય તરફથી સલાહ સૂચનો મળ્યા છે. અમે તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉપરાંત બેન્કના ઓડિટર્સ, ફેડરેશન, રાજ્ય સહકારી અને જિલ્લા સહકારી બેન્ક તરફથી પણ જરૂરી સલાહ સૂચનો અને જરૂરી ટ્રેનીંગ મળી છે તે માટે ફેડરેશનના, રાજ્ય સહકારી અને જિલ્લા સહકારી બેન્કના પદાધિકારીઓનો અને બેન્કના ઓડિટર્સનો આભાર માનીએ છીએ.

બેન્કના સી. ઈ. ઓ., સર્વે અધિકારીગણ અને કર્મચારી ભાઈ-બહેનોએ બેન્કના સર્વાંગી વિકાસ અને પ્રગતિમાં અવિરતપણે જે પરિશ્રમ ઉઠાવી ફાળો આપી રહ્યા છે તે બદલ ધન્યવાદ આપું છું.

આપ સર્વે તમારા કાર્ય ક્ષેત્રમાં કુશલ અને ખૂબ જ પ્રગતિ કરો અને સર્વત્ર સફળતા પ્રાપ્ત કરો, તમારા મનોરથોને પૂર્ણ કરી આ-લોકમાં ખૂબ જ સુખી થાવ તેવી અભ્યર્થના..... સૌનો ખૂબ ખૂબ આભાર..... જય સહકાર..... જય ગુજરાત..... ભારત માતાકી જય ... વંદેમાતરમ.

તા. ૨૪/૦૮/૨૦૨૧

માણસા

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી,

ગોવિંદભાઈ એ . પટેલ

ચેરમેન

**બેન્કના સભાસદ તરીકે સભાસદે એ ધ્યાન રાખવાનું “ આ બેન્કમાં તેઓનું ઓવરસ્યુ/ઘાલખાધનું ખાતુ ક્યારે પણ ન થવું જોઈએ”.**

## Bank Charges Applicable from Dt. 01/11/2019

Service Type	Charges	
<b>Draft/T.T./Pay Order</b>		
[A] Through Own Bank	<b>Non Cash</b>	<b>Cash up to ₹ 49999.00</b>
	₹ 0.50 per ₹ 1000.00+GST	₹ 1.00 per ₹ 1000.00+GST
	Subject to minimum of ₹ 10.00 to maximum ₹ 150.00 + GST	subject to minimum of ₹ 10.00 + GST
[B] Issue of duplicate DD/Pay order (in lieu of instrument)	₹ 150.00 +GST+cost of Stamp paper for indemnity bond	
[C] Cancellation/Revalidation of DD/ Pay Order	₹ 100.00+GST per instrument.	
<b>Out Station Chq Collection</b>		
<b>Inward Bill Collection - IBC</b>	₹ 1.00 Per ₹ 1000.00 subject to minimum commission of ₹ 30.00 + Postage + Other bank charges + GST.	
<b>Outward Bill Collection - OBC</b>	₹ 1.00 per ₹ 1000.00 subject to minimum commission of ₹ 30.00 + Postage + Other bank charges + GST.	
<b>Postage Charges</b>	Ordinary as actual Regd./Courier ₹ 30.00	
<b>RTGS</b>		
[A] RTGS [Inward]	FREE	
[B] RTGS [Outward]	FREE	
<b>NEFT</b>		
[A] NEFT [Inward]	FREE	
[B] NEFT [Outward]	FREE	
<b>ACH</b>		
[A] ACH Inward (Credit)	FREE	
[B] ACH Outward (Debit)	FREE	
[C] ECS Return	₹ 100.00 uniformly per transaction for all reasons attributable to the drawer + GST.	
[D] ECS Mandate	₹ 100.00 Per certifying or verifying customer mandate + GST	
<b>Cheque Return Charges</b>		
[A] Local cheques [Inward]	₹ 100.00 + GST.	
[B] Local cheques [Outward]	₹ 50.00 + GST.	
<b>Cheque book Issue</b>		
[A] Saving Account	First 15 cheque leaves free per annum there after ₹ 1.00 per chq leaf + GST.	
[B] Current/Cash Credit Account	First 45 cheque leaves free per annum there after ₹ 1.00 per chq leaf + GST.	
<b>Issue of Duplicate statement</b>	₹ 10.00 per page+GST	
<b>Issue of Duplicate Pass Book</b>	₹ 50.00 per pass book+GST	
<b>Stop Payment Instruction</b>	₹ 100.00 per instrument (cheque) however (in case of series of cheques) maximum ₹ 100.00 + GST.	
<b>Account Closure</b>	Savings Bank Account closed ₹ 100.00 + GST. Current Account closed ₹ 250.00+GST	
<b>Loss of Token</b>	₹ 30.00 per lost + GST.	
<b>Signature Verification/Attestation</b>	₹ 100.00 per signature + GST.	
<b>Balance/Interest Certificate</b>	FREE	
<b>No Dues Certificate</b>	FREE	
<b>Addition of Name</b>	FREE	
<b>Cash Handling Charges [Only CA/CC A/C.]</b>	₹ 50.00+GST Per lacs Per Day	
<b>Stationery [Folio] Charges</b>	CA/SB A/c. per year ₹ 100.00+GST	
<b>Solvency Certificate</b>	Per ₹ 1.00 lac ₹ 100.00 and Minimum ₹ 100.00 and Maximum ₹ 5000.00 + GST	
<b>Delay Stock/Book Debt Statement</b>	NIL	
<b>Inspection Fees</b>	FREE	
<b>ABB Transection Other Branch</b>		
[A] Cash	FREE	
[B] Transfer	FREE	
[C] Clearing	FREE	



## **Annexure – E** **Independent Auditor's Report**

**To**  
**The Members**  
**The Mansa Nagarik Sahakari Bank Ltd.**  
**Mansa, Dist. Gandhinagar**

### **Opinion**

1. We have audited the financial statements of **The Mansa Nagarik Sahakari Bank Ltd.**, which comprise the Balance Sheet as at 31st March, 2021, the Statement of Profit and Loss and the Statement of Cash Flows for the year then ended and notes to the financial statements, including a summary of significant accounting policies and other explanatory information.
2. In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements together with the notes thereon give the information required by Banking Regulation Act, 1949, and Multi State Co-operative Societies Act, 2002 and Multi State Co-operative Societies Rules, 2002 and guideline issued by Reserve Bank of India and in the manner so required for bank and are in conformity with generally accepted in India and give:
  - a. The Balance Sheet, read with the notes thereon is a full and fair Balance Sheet containing all the necessary particulars, is properly drawn up so as to exhibit a true and fair view of the state of affairs of the Bank as at 31<sup>st</sup> March, 2021;
  - b. The Profit and Loss Account, read with notes thereon shows a true balance of profit; and
  - c. The Cash Flow Statement gives a true and fair view of the cash flow for the year ended on the date.

### **Basis for Opinion**

3. We conducted our audit of the financial statements in accordance with the Standards on Auditing issued by ICAI. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibility for the Audit of the Financial Statements section of our report. We are independent of the entity in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India (ICAI) together with the ethical requirements that are relevant to our audit of the financial statements, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the ICAI's Code of Ethics. We believe that the audit evidence obtained by us is sufficient and appropriate to provide a basis for our audit opinion on the financial statements.

### **Responsibility of Management & Those Charged with Governance for the Financial Statements**

4. The Company's Board of Directors is responsible for the preparation of these standalone financial statements that give a true and fair view of the financial position, financial performance and cash flows of the Bank in accordance with the Accounting policies and other accounting principles generally accepted in India and with Provisions of the Banking Regulation Act, 1949, and circulars and guidelines issued by the Reserve Bank of India from time to time and the guidelines issued by the National Bank for Agricultural and Rural Development, the Central Registrar of Co-Operative Societies, the Multi State Co-Operative Societies Act, 2002, the Multi State Co-Operative Societies Rules, 2002 (as applicable) This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding the assets of the Entity and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statement that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error. In preparing the financial statements, management is responsible for assessing the Entity's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of

accounting unless management either intends to liquidate the Entity or to cease operations, or has no realistic alternative but to do so.

Those charged with governance are also responsible for overseeing the Entity's financial reporting process.

### **Auditor's Responsibility**

5. Our objective are to obtain reasonable assurance about whether the financial statement as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatement can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decision of users taken on the basis of the financial statement.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by the management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Bank's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

### **Report on Other Legal Regulatory Requirements**

6. The Balance Sheet and Profit and Loss Account have been drawn up in accordance to the Banking Regulation Act, 1949 and the Multi State Co-operative Societies Act, 2002, the Multi State Co-operative Rules, 2002.
7. We Further report that:
  - a) We have obtained all the information and explanation, which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit and have found them to be satisfactory;
  - b) The transaction of the Bank which came to our notice have been within the powers of the bank;

- c) In our opinion, proper books of account as required by law have been kept by the Bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purpose of our audit have been received from the branches/offices.
- d) The Balance Sheet, the Profit and Loss Account and Statement of Cash Flows dealt with by this report are in agreement with the books of account and returns;

**Schedules formatting part of Auditors report on the Financials of**

8. As required under Rules 27(3) of the Multi State Co-operative Societies Rules,2002, we report on the matters specified in that Rules as under: -
- a) During the course of audit, we have generally not come across any material transactions which appear to be contrary to the previous of the Multi-State Co-operative Societies Act, 2002, the rules or the bye-laws of the Bank.
- b) During the course of audit, we have not come across material and significant transactions which appear to be contrary to the guidelines issued by the Reserve Bank of India and National Bank of Agriculture and Rural Development.
- c) Money belonging to the Bank which appears to be bad or doubtful of recovery are stated in the annexures.
- d) As per information given to us and to the best of our knowledge, there are no loans given by the Bank to the members of the Board except those permissible under RBI guidelines;
- e) During the course of our audit we have generally not come across any violation of guidelines, conditions etc., issued by the Reserve Bank of India or National Bank for Agriculture and Rural Development.
- f) To the best of our knowledge, there are no matters that have been specified by the Central Registrar of Co-operative Societies in this regard.

**FOR,**  
**M/s Urvish Patel & Co.**  
 CHARTERED ACCOUNTANTS  
 F.R.N.: - 124710W

**(Urvish Ratilal Patel)**  
**PARTNER**  
**M. NO. : - 115833**  
**PANEL NO.: - 79**  
**UDIN : -21115833AAAAEH1446**

**PLACE :- Ahmedabad**  
**DATED :-01/09/2021**

**Interest Rate applicable to all type of Savings,  
 Recurring and Term Deposits as per below mention from Date: - 01/03/2021.**

**Savings 3.00**

**Term & Recurring Deposits**

Period / Term/ Time	Interest Rate %	
	Normal	Only for Senior Citizen
30 Days To 90 Days	3.50 %	6.25 %
91 Days To 180 Days	4.25 %	
181 Days To 365 Days	5.50 %	
13 Months To 24 Months	5.75 %	6.25 %
25 Months To 60 Months	6.00 %	6.50 %
61 Months To 108 Months	5.25 %	5.75 %
Above 108 Months	4.00 %	4.50 %

**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Capital And Liabilities ભંડોળ તથા દેવા	Sch. જોડાણ	31.03.2021	
₹			₹	₹
10,00,00,000.00	<b>1 Capital - શેર ભંડોળ</b> a) Authorised Capital - અધિકૃત શેર ભંડોળ 40,00,000 Share Of ₹ 25/- Each 40,00,000 દરેક શેર ₹ 25/- પ્રમાણે b) Subscribed Capital - બહાર પડેલ શેર ભંડોળ 40,00,000 Share Of ₹ 25/- Each 40,00,000 દરેક શેર ₹ 25/-પ્રમાણે		10,00,00,000.00	
	Share-શેર	Particular	Share-શેર	
	2020	વિગત	2021	
	25,25,170	Each Share- દરેક શેર 25/- નાં	26,11,001	
	<b>25,25,170</b>	<b>Total Shares- કુલ શેર્સ</b>	<b>26,11,001</b>	
<b>6,31,29,250.00</b>	d) Individuals-વ્યક્તિઓ e) Co-op. Institutes- સહકારી સંસ્થાઓ f) State Government- રાજ્ય સરકારશ્રીએ ધારણ કરેલ શેર ભંડોળ g) Nominal Member -નોમિનલ મેમ્બર		6,52,75,025.00	<b>6,52,75,025.00</b>
0.00			0.00	<b>0.00</b>
<b>20,89,08,206.21</b>	<b>2 Reserve Fund &amp; Other Reserves- અનામત ભંડોળ અને અન્ય ભંડોળ</b>			<b>22,25,08,386.32</b>
5,03,16,153.00	1) Statutory Reserve - અનામત ભંડોળ (કાયદા મુજબ)		5,44,43,063.00	
84,76,982.40	2) Building Fund- મકાન ફંડ		1,05,57,182.40	
31,64,103.00	3) Dividend Equalization Fund ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ		44,27,103.00	
2,03,19,250.00	4) Sp. BDDR Fund- સ્પે. બિડીડીઆર ફંડ		2,27,94,250.00	
73,41,541.49	5) Bad & Doubtful Fund -શકમંદ લેણાં અનામત		1,07,87,174.60	
1,00,00,000.00	6) Inv. Depreciation Fund ઈન્વે. ધસારા ફંડ		30,75,000.00	
52,00,000.00	a) Standard Assets Reserve સ્ટાન્ડર્ડ એસેટ્સ રિઝર્વ		52,00,000.00	
68,37,074.00	b) Contingency Fund કન્ટીજન્સી ફંડ		68,37,074.00	
2,52,577.25	c) Investment Fluctuation Fund - રોકાણ વધઘટ ફંડ		86,40,777.25	
8,74,00,000.00	d) BDDR Funds બિડીડીઆર ફંડ		8,74,00,000.00	
69,60,000.00	e) Revaluation Reserve રિવેલ્યુએશન રિઝર્વ		34,80,000.00	
61,902.85	f) General Reserve- જનરલ રિઝર્વ		63,739.85	
3,68,995.60	g) Charity Fund & good luck fund ધર્માદા ફંડ ધર્માદા તથા શુભકામ અંગેનું ફંડ		3,75,095.60	
1,18,995.60	h) Co-operative Propaganda fund સહકાર પ્રચાર ફંડ		1,25,095.60	
7,76,639.82	i) Members' Gift Fund સભાસદ ગીફ્ટ ફંડ		7,76,639.82	
84,000.00	j) Development Fund વિકાસ ફંડ		84,000.00	
2,29,991.20	k) Staff /Members Welfare/Benefit Fund- સ્ટાફ/મેમ્બર વેલ્ફેર ફંડ/કલ્યાણ નિધી		2,42,191.20	
10,00,000.00	l) Golden Jubilee Fund સુવર્ણ જયંતી ફંડ		30,00,000.00	
	m) Education Fund શિક્ષણ ફાળો		2,00,000.00	
	<b>3 Principal Subsidiary State Partnership Fund Account -ગૌણ રાજ્ય ભાગીદારી નિધી for Share Capital of- શેર ભંડોળ માટે</b>			
	(i) Central Co-op. Bank - સેન્ટ્રલ કો-ઓપ. બેંક			
	(ii) Primary Agricultural Co-op. Credit Society પ્રાથમિક ખેતી વિષયક સહકારી શરાફી મંડળી			
	(iii) Other Societies - અન્ય મંડળીઓના શેરમાં			
<b>27,20,37,456.21</b>	<b>Total Carried Forward - સરવાળો આગળ લઈ ગયા</b>		<b>28,77,83,411.32</b>	

**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Property And Assets મિલકત તથા લેણાં	Sch. જોડાણ	31.03.2021	
₹			₹	₹
2,68,20,906.00	<b>1 Cash - રોકડ</b> On hand and balance with Reserve Bank Of India, State Bank Of India, State Co-op. Bank & Central Co-op. Bank હાથ ઉપર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રાજ્ય સહકારી બેંક, મધ્યસ્થ સહકારી બેંકમાં		3,24,80,044.00	<b>3,24,80,044.00</b>
<b>39,50,03,460.19</b>	<b>2 Balance With Other Bank - અન્ય બેંકમાં સિલક</b>	<b>01</b>		<b>52,00,59,222.43</b>
8,58,22,673.19	1) Current Deposits - ચાલુ ખાતલ		16,13,72,501.43	
	2) Savings Bank Deposits - સેવિંગ્સ બેંક ખાતલ			
30,91,80,787.00	3) Fix Deposits - બાંધી મુદત થાપણ (with State & Dist. Co-op. Bank - રાજ્ય અને મધ્યસ્થ સહકારી બેંકમાં)		35,86,86,721.00	
3,25,00,000.00	<b>3 Money at call and short notice</b> કોલ અને ટૂંકી મુદતની નોટિસની થાપણો		0.00	<b>0.00</b>
<b>48,20,01,445.00</b>	<b>4 Investments - રોકાણો</b>	<b>01</b>		<b>66,78,39,545.00</b>
46,48,56,445.00	1) In Central & State Government Securities (at book value) મધ્યસ્થ અને રાજ્ય સરકારી જામીનગીરીમાં Face value ₹6572.28 lakh Mkt. Value ₹6847.76 lakh દર્શનીય કિંમત ₹6572.28 લાખ બજાર કિંમત ₹ 6847.76 લાખ		65,06,94,545.00	
	2) Other Trustee Securities બીજી ટ્રસ્ટ જામીનગીરીઓમાં			
6,45,000.00	3) Shares In Co-op. Institution (other than item (5) below) સહકારી સંસ્થાઓમાં શેરમાં (નીચેની આઈટમ નં (5) સિવાયના)		6,45,000.00	
1,65,00,000.00	4) Other Investment (to be specified) અન્ય રોકાણો (સ્પષ્ટ જણાવવા) CRB Capital Mkt		1,65,00,000.00	
0.00	5 Investments in Principal / Subsidiary મુખ્ય/ગૌણ ભાગીદાર નિધિનું રોકાણ State Partnership Fund In Shares of રાજ્ય ભાગીદારી નિધિનાં શેર્સ  1) Central Co-op. Bank - સેન્ટ્રલ કો.ઓપ. બેંક 2) Primary Agr. Cr. Soc.- પ્રાથમિક સહકારી મંડળીઓ 3) Other Societies - અન્ય મંડળીઓ		0.00	<b>0.00</b>
<b>93,63,25,811.19</b>	<b>Total Carried Forward - સરવાળો આગળ લઈ ગયા</b>			<b>1,22,03,78,811.43</b>

**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Capital And Liabilities બંડોળ તથા દેવા	Sch. જોડાણ	31.03.2021
₹			₹
<b>27,20,37,456.21</b>	<b>Total Brought Forward - સરવાળો આગળ લાવ્યાં</b>		<b>28,77,83,411.32</b>
<b>1,65,45,37,363.91</b>	<b>4 Deposits &amp; Other Accounts થાપણો અને અન્ય ખાતાઓ</b>		<b>1,90,64,57,550.06</b>
1,09,52,38,234.70	1) Fixed Deposits- બાંધી મુદતની થાપણો a) Individuals- વ્યક્તિઓ b) Central Co-op. Bank - સેન્ટ્રલ કો-ઓપ. બેંક c) Other Societies - અન્ય મંડળીઓ સંસ્થાઓ		1,22,97,01,557.00
45,67,30,426.80	2) Savings Bank Deposits - સેવિંગ્સ બેંક થાપણો a) Individuals- વ્યક્તિઓ b) Central Co-op. Bank - સેન્ટ્રલ કો-ઓપ. બેંક c) Other Societies - અન્ય મંડળીઓ સંસ્થાઓ		53,22,66,217.14
10,25,68,702.41	3) Current Deposits- ચાલુ થાપણો a) Individuals- વ્યક્તિઓ b) Central Co-op. Bank - સેન્ટ્રલ કો-ઓપ. બેંક c) Other Societies - અન્ય મંડળીઓ સંસ્થાઓ d) Over-Due Fix Deposits - પાકી ગયેલ થાપણો		14,44,89,775.92
	4) Recurring Deposits - રીકરીંગ થાપણો		
	5) Other Deposits- અન્ય થાપણો		
<b>0.00</b>	<b>5 Borrowings - ડરજ</b>		<b>67,944.00</b>
	1) From Reserve Bank Of India -રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા Guj.State Co-op. Bank - ગુજરાત રાજ્ય સહકારી બેંક Ahmedabad Dist. Co-op. Bank Ltd. મધ્યસ્થ સહકારી બેંક પાસેથી		
	A) Short Term Loans, Cash Credit & Over drafts CBLO which is secured against ટૂંકી મુદતની લોન, કેશક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ સીબીએલઓ જે ગવર્નમેન્ટ સિક્યુરીટીઝ તારણ સામે a) Govt. & other approved securities સરકારી અને બીજા માન્ય જમીનગીરીઓ b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ		
	B) Medium Term Loans of which secured against મધ્યમ મુદતની લોન જે પૈકી નીચે મુજબના તારણ સામે a) Govt. & other approved securities સરકારી અને બીજા માન્ય જમીનગીરીઓ b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ		
	C) Long Term Loans of which secured against લાંબી મુદતની લોન જે પૈકી નીચે મુજબના તારણ સામે a) Govt. & other approved securities સરકારી અને બીજા માન્ય જમીનગીરીઓ b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ		
	2) From the State Bank of India સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી		
<b>1,92,65,74,820.12</b>	<b>Total Carried Forward - સરવાળો આગળ લઈ ગયા</b>		<b>2,19,43,08,905.38</b>

**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Property And Assets	Sch.	31.03.2021	
₹	મિલકત તથા લેણી	જોડાણ	₹	₹
<b>93,63,25,811.19</b>	<b>Total Brought Forward - સરવાળો આગળ લાવ્યાં</b>			<b>1,22,03,78,811.43</b>
<b>97,55,94,984.41</b>	<b>6 Advances - ધિરાણો</b>	<b>02</b>		<b>96,76,30,417.29</b>
<b>61,36,99,387.34</b>	1) Short term loans, cash credit, overdrafts and bills discounted of which secured against ટૂંકી મુદતની લોન, કેશ ક્રેડિટ, ઓવર ડ્રાફ્ટ અને વટવાયેલ બિલો જે પૈકી નીચે મુજબના તારણો સામે		<b>58,20,34,788.46</b>	
61,35,21,890.28	(a) Govt. & Other Approved Securities સરકારી અને બીજી જામીનગીરીઓમાં		58,19,38,773.40	
1,77,497.06	(b) Other Tangible Securities Of the above advances amount due બીજી ટેન્જીબલ જામીનગીરીઓમાં ઉપરનાં નિર્દિષ્ટધિરાણો પૈકી બાકી રકમ		96,015.06	
<b>2,07,91,718.22</b>	(i) Amount dues from Individual રકમ બાકી વ્યક્તિ પાસે ₹ 1.77 Lakh			
	(ii) Amount overdue ₹ 400.61 Lakh મુદતવીતી બાકી રકમ			
	(iii) Amount considered bad & doubtful Recovery. ₹ 261.85 Lakh અંદાજીત ખરાબ અને શકમંદ			
<b>2,07,91,718.22</b>	2) Midium Term Loans - મધ્યમ મુદતી લોન of which secured against જે પૈકી નીચે મુજબના તારણો સામે		<b>6,50,80,147.23</b>	
2,07,91,718.22	(a) Govt. & Other Approved Securities સરકારી અને બીજી જામીનગીરીઓમાં		4,23,85,378.23	
0.00	(b) Other Tangible Securities Of the above advances amount due બીજી ટેન્જીબલ જામીનગીરીઓમાં ઉપરનાં નિર્દિષ્ટધિરાણો પૈકી બાકી રકમ		2,26,94,769.00	
	(i) Amount dues from Individual રકમ બાકી વ્યક્તિ પાસે ₹ 134.91 Lakh			
	(ii) Amount overdue ₹ 3.47 Lakh મુદતવીતી બાકી રકમ			
	(iii) Amount considered bad & doubtful Recovery. ₹ 7.91 Lakh અંદાજીત ખરાબ અને શકમંદ			
<b>34,11,03,878.85</b>	2) Long Term Loans - લાંબી મુદતી લોન of which secured against જે પૈકી નીચે મુજબના તારણો સામે		<b>32,05,15,481.60</b>	
33,16,34,464.22	(a) Govt. & Other Approved Securities સરકારી અને બીજી જામીનગીરીઓમાં		31,19,00,816.45	
94,69,414.63	(b) Other Tangible Securities Of the above advances amount due બીજી ટેન્જીબલ જામીનગીરીઓમાં ઉપરનાં નિર્દિષ્ટધિરાણો પૈકી બાકી રકમ		86,14,665.15	
	(i) Amount dues from Individual રકમ બાકી વ્યક્તિ પાસે ₹ 1964.16 Lakh			
	(ii) Amount overdue ₹ 22.01 Lakh મુદતવીતી બાકી રકમ			
	(iii) Amount considered bad & doubtful Recovery. અંદાજીત ખરાબ અને શકમંદ ₹ 75.26 Lakh			
<b>1,91,19,20,795.60</b>	<b>Total Carried Forward - સરવાળો આગળ લઈ ગયા</b>			<b>2,18,80,09,228.72</b>

**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Capital And Liabilities બંડોળ તથા દેવાં	Sch. જોડાણ	31.03.2021
₹			₹
1,92,65,74,820.12	<b>Total Brought Forward - સરવાળો આગળ લાવ્યાં</b>		2,19,43,08,905.38
0.00	<p>A) Short Term Loans, Cash Credit &amp; Over drafts of which secured against ટૂંકી મુદતની લોન, કેશક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ પૈકી</p> <p>a) Govt. &amp; other approved securities સરકારી અને બીજા માન્ય જામીનગીરીઓ</p> <p>b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ 67,944.00</p> <p>B) Medium Term Loans of which secured against મધ્યમ મુદતની લોન જે પૈકી નીચે મુજબના તારણ સામે</p> <p>a) Govt. &amp; other approved securities સરકારી અને બીજા માન્ય જામીનગીરીઓ</p> <p>b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ</p> <p>C) Long Term Loans of which secured against લાંબી મુદતની લોન જે પૈકી નીચે મુજબના તારણ સામે</p> <p>a) Govt. &amp; other approved securities સરકારી અને બીજા માન્ય જામીનગીરીઓ</p> <p>b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ</p> <p>3) From the State Government રાજ્ય સરકાર પાસેથી</p> <p>A) Short Term Loans, Cash Credit &amp; Over drafts of which secured against ટૂંકી મુદતની લોન, કેશક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ પૈકી</p> <p>a) Govt. &amp; other approved securities સરકારી અને બીજા માન્ય જામીનગીરીઓ</p> <p>b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ</p> <p>B) Medium Term Loans of which secured against મધ્યમ મુદતની લોન જે પૈકી નીચે મુજબના તારણ સામે</p> <p>a) Govt. &amp; other approved securities સરકારી અને બીજા માન્ય જામીનગીરીઓ</p> <p>b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ</p> <p>C) Long Term Loans of which secured against લાંબી મુદતની લોન જે પૈકી નીચે મુજબના તારણ સામે</p> <p>a) Govt. &amp; other approved securities સરકારી અને બીજા માન્ય જામીનગીરીઓ</p> <p>b) Other tangible securities ટેન્જીબલ સિક્યુરીટીઝ</p> <p>4) Loans from other sources અન્ય સાધનોથી લીધેલ લોન (Sources and securities to be specified)</p>		
1,92,65,74,820.12	<b>Total Carried Forward - સરવાળો આગળ લઈ ગયા</b>		2,19,43,08,905.38



**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Property And Assets મિલકત તથા લેણાં	Sch. જોડાણ	31.03.2021	
₹			₹	₹
<b>1,91,19,20,795.60</b>	<b>Total Brought Forward - સરવાળો આગળ લાવ્યાં</b>		<b>2,18,80,09,228.72</b>	
<b>2,39,19,733.22</b>	<b>7 Interest Receivable - મળવાપાત્ર વ્યાજ</b>			<b>2,34,42,358.98</b>
64,90,369.22	Of which overdue considered bad and doubtful recovery (as per contra)- જે પૈકી મુદતવીતી વ્યાજની રકમ (સામે દર્શાવ્યા મુજબ)		56,00,996.98	
1,74,29,364.00	Int. Receivable From Investment રોકાણો ઉપર મળવાપાત્ર વ્યાજ		1,78,41,362.00	
0.00	<b>8 Bills Receivable - બિલ્સ રીસીવેબલ</b>		0.00	<b>0.00</b>
	Bills for collection (as per contra) બિલ્સ ફોર કલેક્શન (સામે દર્શાવ્યા પ્રમાણે)			
67,62,71,461.04	<b>9 Branch Adjustment - શાખાઓ ખાતે (એડ્જસ્ટમેન્ટ)</b>		67,62,96,461.04	<b>67,62,96,461.04</b>
<b>1,16,83,555.00</b>	<b>10 Premises / Building (Less: Depreciation)</b>			<b>77,31,200.00</b>
1,56,88,394.00	(Less : Depreciation) સ્થાવર મિલકત (ઘસારા બાદ)		1,16,83,555.00	
-40,04,839.00			-39,52,355.00	
	<b>11 Capital work in Progress - કેપિટલ વર્ક ઈન પ્રોગ્રેસ</b>			
<b>52,26,270.00</b>	<b>12 Furniture Fixture &amp; Other Assets</b>			<b>53,81,019.00</b>
	(Less : Depreciation) - રાચરચીલું, જડતર તથા અન્ય મિલકતો (ઘસારા બાદ)			
27,61,380.80	1) Furniture Fixtures- રાચરચીલું, જડતર		25,40,216.00	
8,81,418.00	2) Computer- કોમ્પ્યુટર		20,46,017.47	
5,25,148.00	3) Locker-લોકર		4,72,633.00	
6,30,186.00	4) Note Counting Machine-નોટ કાઉન્ટીંગ મશીન		5,79,035.00	
1,07,883.00	5) U.P.S.- યુ.પી.એસ.		91,701.00	
3,622.00	6) E.P.B.X. - ઈ.પી.બી.એક્ષ.		3,079.00	
10,772.00	7) Bio Metric Attendance Machines - બાયો મેટ્રિક હાજરી મશીન		9,156.00	
1,71,057.00	8) C.C.TV Camera - સી.સી. ટી.વી. કેમેરા		1,14,044.00	
3,31,387.00	9) Scanner - સ્કેનર		2,87,829.00	
3,56,940.00	10) Solar Power Plant - સોલાર પાવર પ્લાન્ટ		2,14,164.00	
3,54,247.60	11) Generator- જનરેટર		3,01,110.00	
61,34,041.40			66,58,984.47	
-9,07,771.40	Less: Depreciation - બાદ ઘસારો		-12,77,965.47	
52,26,270.00			53,81,019.00	
<b>14,55,608.00</b>	<b>13 Vehicles (Less: Depreciation)</b>			<b>12,37,267.00</b>
	વાહન (ઘસારા બાદ)			
17,12,480.00	1) Innova Car - ઈનોવા કાર		14,55,608.00	
17,12,480.00			14,55,608.00	
-2,56,872.00	Less: Depreciation - બાદ ઘસારો		-2,18,341.00	
14,55,608.00			12,37,267.00	
<b>2,63,04,77,422.86</b>	<b>Total Carried Forward - સરવાળો આગળ લઈ ગયા</b>		<b>2,90,20,97,534.74</b>	

**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Capital And Liabilities	Sch.	31.03.2021	
₹	ભંડોળ તથા દેવાં	જોડાણ	₹	₹
<b>1,92,65,74,820.12</b>	<b>Total Brought Forward - સરવાળો આગળ લાવ્યાં</b>			<b>2,19,43,08,905.38</b>
0.00	<b>6</b> Bills for collection being bills receivable (as per contra) બિલ્સ ફોર કલેક્શન (સામે દર્શાવ્યા મુજબ)		0.00	<b>0.00</b>
67,62,71,461.04	<b>7</b> Branch Adjustment શાખાઓ ખાતે (એડ્જસ્ટમેન્ટ)		67,62,71,461.04	<b>67,62,71,461.04</b>
64,90,369.22	<b>8</b> Overdue Interest Reserve (as per contra) મુદત બહારનાં વ્યાજ માટે અનામત (સામે દર્શાવ્યા મુજબ)		56,00,616.98	<b>56,00,616.98</b>
17,14,093.00	<b>9</b> Interest Payable - ચૂકવવાપાત્ર વ્યાજ		19,13,638.00	<b>19,13,638.00</b>
1,83,54,089.21	<b>10</b> Other Laibilities - અન્ય જવાબદારીઓ		1,68,11,986.41	<b>1,68,11,986.41</b>
0.00	<b>11</b> Provision For Income Tax -ઈન્કમ ટેક્સ પ્રોવિઝન		0.00	<b>0.00</b>
<b>1,65,00,000.00</b>	<b>12</b> Profit & Loss Account- નફા નુકશાન ખાતું			<b>2,37,00,000.00</b>
1,41,75,000.00	As per last BALANCE Sheet- ગયા વર્ષનાં સરવૈયા મુજબ નફો		1,65,00,000.00	
-1,41,75,000.00	Less : Appropriation - ફાળવણી		-1,65,00,000.00	
1,65,00,000.00	Add.: Profit brought from the Profit & Loss Account ઉમેરો: ચાલુ સાલના નફા નુકશાનના હિસાબ મુજબ નફો		2,37,00,000.00	
	<b>13</b> Contigent Liabilities - આકસ્મિક જવાબદારીઓ			<b>0.00</b>
	a) Outstanding liabilities for Guarantee issued (against 100 % FD) ખાતા:-2 ₹ 7,82,000.00 આપેલ ગેરંટીઓ સામે (૧૦૦% એફ.ડી. સામે)			
	b) Laibilities of DEAF ડેફ સ્કીમ ખાતા :- 3687 ₹ 33,13,464.30			
<b>2,64,59,04,832.59</b>	<b>Total -સરવાળો</b>			<b>2,91,86,06,607.81</b>

Note:- As per our separate report of even date and subject to Notes on accounts and our Audit Memo.

નોંધ:- અમારા આજ તારીખનાં અલગ રિપોર્ટ તથા ઓડિટ મેમોનાં સામાન્ય શેરોને આધિન.

Shri Govindbhai A. Patel  
Chairman

Shri Kanubhai H. Patel  
Vice Chairman

Shri Anilbhai A. Patel  
Director

Shri Mahendrabhai K. Patel  
Director

M/s Urvish Patel & Co.  
Urvish R. Patel (Partner)  
Chartered Accountants

Sushri Manjulaben  
K. Prajapati  
Director

Shri Narendrakumar  
K. Parmar  
Director

DATE :- 01/09/2021

Penal No.: 79

PLACE :- Ahmedabad

Membership No. :- 115833

UDIN :- 21115833AAAAEH1446 Dt. 01/09/2021

**BALANCE SHEET AS ON 31-03-2021 તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજનું સરવૈયું**

31.03.2020	Property And Assets	Sch.	31.03.2021	
₹	મિલકત તથા લેણાં	જોડાણ	₹	₹
<b>2,63,04,77,422.86</b>	<b>Total Brought Forward - સરવાળો આગળ લાવ્યાં</b>			<b>2,90,20,97,534.74</b>
<b>1,54,27,409.73</b>	<b>14 Other Assets (to be Specified)</b> અન્ય મિલકતો (સ્પષ્ટ બતાવવી)			<b>1,65,09,073.07</b>
3,08,799.00	01) Stationery Stock - સ્ટેશનરી સ્ટોક		2,39,959.00	
9,900.00	02) E-Stamp - ઈ સ્ટેમ્પીંગ		9,900.00	
39,11,595.94	03) Advance Suspens - એડવાન્સ સસ્પેન્સ		39,11,595.94	
26,600.00	04) Adhesive Stamps - અધેસિવ સ્ટેમ્સ		31,400.00	
5,199.00	05) Telephone Deposit - ટેલીફોન ડિપોઝીટ		5,199.00	
62,597.00	06) UGVCL Deposit - યુજીવીસીએલ ડિપોઝીટ		62,597.00	
2,28,632.36	07) DEAF Receivable- ડેફ રીસીવેબલ		2,95,576.36	
1,00,00,000.00	08) Advance Tax - એડવાન્સ ટેક્સ		85,00,000.00	
30,181.00	09) Of Locker Deposits- લોકર ડિપોઝીટના		0.00	
1,800.00	10) Locker Stamps - લોકર સ્ટેમ્સ		0.00	
-	11) Exgratia Receivable - એક્ઝગ્રેસિયા રીસીવેબલ		9,62,550.34	
7,11,706.00	12) T.D.S. Receivable 2012-13 ટી.ડી.એસ. રીસીવેબલ		7,11,706.00	
1,26,871.43	13) T.D.S. Receivable 2017-18 ટી.ડી.એસ. રીસીવેબલ		1,26,871.43	
0.00	14) T.D.S. Receivable 2020-21 ટી.ડી.એસ. રીસીવેબલ		70,806.00	
0.00	15) IT Receivable 2019-20 - ઈન્કમ ટેક્સ રીસીવેબલ		4,06,900.00	
0.00	16) Incentive Of ANGSY Rec. - ઇન્સે. ANGSY રીસીવેબલ		6,33,000.00	
0.00	17) Int. Subsidy on ANGSY Receivable ઈન્ટ. સબસીડી ANGSY રીસીવેબલ		5,41,012.00	
3,528.00	18) Pan Card - પાન કાર્ડ		-	
0.00	<b>15 Goodwill- ગુડવિલ</b>			<b>0.00</b>
0.00	<b>16 Non - Banking Assets - નોન બેન્કીંગ મિલકત</b> acquired in satisfaction of claim (stating mode valuation) દાવાઓ પેટે પ્રાપ્ત કરેલી મિલકતો			<b>0.00</b>
0.00	<b>17 Profit &amp; Loss Account - નફા નુકશાન ખાતે</b>			<b>0.00</b>
<b>2,64,59,04,832.59</b>	<b>Total -સરવાળો</b>			<b>2,91,86,06,607.81</b>

Shri Kamlesh J. Shah  
M.D./C.E.O./G.M.

Shri Amrutbhai S. Patel  
Director

Shri Jayantibhai A. Patel  
Director

Shri Ramabhai T. Patel  
Director

Shri Bhikhabhai K.  
Patel  
Director

Shri Mahendrabhai R.  
Panchal  
Director

Smt. Gomtiben B.  
Patel  
Director

Shri Bharatkumar J.  
Chaudhari  
Director

Shri Manibhai J. Patel  
Co-Op. Director

Shri Dilipbhai P. Patel  
Co-Op. Director

Shri Hardik R. Patel (C.A.)  
Prof. Director

**PROFIT AND LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31-03-2021**

**તા.૩૧-૦૩-૨૦૨૧નાં રોજ પૂરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું**

31.03.2020	Expenditure	Sch.	31.03.2021	
₹	ખર્ચ	જોડાણ	₹	₹
9,93,69,193.40	1 Interest On Deposits, Borrowings etc. થાપણો અને કરજ ઉપર વ્યાજ		9,94,46,054.48	
2,15,82,006.77	2 Salaries & Allowances, Providend Fund & Bonus etc. પગાર, ભથ્થાં, પ્રો. ફંડ તથા બોનસ વિગેરે		1,99,48,616.10	
0.00	3 Directors & Local Committee Member's Fees & allowances ડિરેક્ટર્સ અને સ્થાનિક કમિટીના સભ્યોની ફી તથા ભથ્થાં		0.00	
33,03,115.15	4 Rent, Taxes, Insurance, Lighting etc. ભાડું, કરવેરા, વીમો, વિજળી વિગેરે		42,99,368.00	
3,151.00	5 Legal Fees - લીગલ ફી		37,830.51	
3,32,440.96	6 Postage, Telegram & Telephone charges તાર, ટપાલ, અને ટેલિફોન ચાર્જિસ		2,46,960.89	
3,44,500.00	7 Audit Fees -ઓડિટ ફી		2,30,500.00	
16,89,482.40	8 Depreciation on and repairs to property ઘસારો અને મિલકત મરામત		19,68,661.47	
2,01,544.12	9 Stationery, Printing & Xerox etc. સ્ટેશનરી, છાપકામ, ઝેરોક્ષ વિગેરે		64,626.80	
56,37,311.66	10 Other Expenditure - અન્ય ખર્ચ		77,22,543.93	
27,18,962.58	11 B.D.D.R. બેંડ ડેબ્ટ રિઝર્વ ખાતે		34,45,633.11	
0.00	12 Security Premium Amotization સિક્યોરીટી પ્રિમીયમ એમોટાઈઝેશન		10,000.00	
0.00	13 Invetment Depreciation Fund રોકાણ ઘસારા ફંડ		0.00	
7,46,110.00	14 Income Tax ઈન્કમ ટેક્ષ		-3,98,484.00	
-23,59,540.00	15 Income Tax Appeal Provision ઈન્કમ ટેક્ષ અપીલ પ્રોવિઝન		0.00	13,70,22,311.29
	2,67,24,000.00 Profit Before Tax ટેક્ષ પહેલાં નો નફો		3,30,35,100.00	0.00
1,02,24,000.00	-1,02,24,000.00 Income Tax Provision ઈન્કમ ટેક્ષ જોગવાઈ		-93,35,100.00	93,35,100.00
1,65,00,000.00	Profit carried forward to Balance Sheet નફો જે સરવૈયામાં લઈગયા			2,37,00,000.00
16,02,92,278.04	<b>Total -સરવાળો</b>			17,00,57,411.29

Note:- As per our separate report of even date and subject to Notes on accounts and our Audit Memo.

નોંધ:- અમારા આજ તારીખનાં અલગ રિપોર્ટ તથા ઓડિટ મેમાનાં સામાન્ય શેરોને આધિન.

Shri Govindbhai A. Patel  
Chairman

Shri Kanubhai H. Patel  
Vice Chairman

Shri Anilbhai A. Patel  
Director

Shri Mahendrabhai K. Patel  
Director

M/s Urvish Patel & Co.  
Urvish R. Patel (Partner)  
Chartered Accountants

Sushri Manjulaben  
K. Prajapati  
Director

Shri Narendrakumar  
K. Parmar  
Director

DATE :- 01/09/2021 Penal No.: 79  
PLACE :- MANSNA Membership No. :- 115833  
UDIN :- 21115833AAAAEH1446 Dt. 01/09/2021

**PROFIT AND LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31-03-2021**

**૨૧.૩૧-૦૩-૨૦૨૧નાં રોજ પૂરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું**

31.03.2020	Income આવક	Sch. જોડાણ	31.03.2021	
			₹	₹
15,89,36,490.92	1 Interest & Discount વ્યાજ અને વટાવ		16,18,34,374.67	
84,615.11	2 Commission, Exchange & Brokerage કમિશન, વટાવ અને દલાલી		98,724.03	
-	3 Subsidies & Donation - સબસિડી અને ડોનેશન		-	
-	4 Income from non banking asstes and profit from sales or dealing with such assets. નોન બેંકિંગ અસ્ક્યામતોના વેચાણ અગર હેરફેરથી થયેલ આવક		-	
750.00	5 Dividend Income - ડિવિડન્ડ આવક		0.00	
12,70,422.01	6 Other Income - અન્ય આવક		81,24,312.59	
<b>16,02,92,278.04</b>				<b>17,00,57,411.29</b>
<b>16,02,92,278.04</b>	<b>Total -સરવાળો</b>			<b>17,00,57,411.29</b>

Shri Kamlesh J. Shah  
M.D./C.E.O./G.M.

Shri Amrutbhai S. Patel  
Director

Shri Jayantibhai A. Patel  
Director

Shri Ramabhai T. Patel  
Director

Shri Bhikhabhai K.  
Patel  
Director

Shri Mahendrabhai R.  
Panchal  
Director

Smt. Gomtiben B.  
Patel  
Director

Shri Bharatkumar J.  
Chaudhari  
Director

Shri Manibhai J. Patel  
Co-Op. Director

Shri Dilipbhai P. Patel  
Co-Op. Director

Shri Hardik R. Patel (C.A.)  
Prof. Director

**૦૧. અન્ય બેંકોમાં રોકડ / સિલક અને રોકાણો**

31/03/2020	A ચાલુ / કરંટ ખાતે		31/03/2021	
44,301,976.82	૧	ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ	40,995,748.15	
1,780,529.76	૨	સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, માણસા	15,414,371.86	
321,375.27	૩	બેંક ઓફ બરોડા, માણસા	1,676,625.07	
7,389,954.40	૪	આઈ.ડી.બી. આઈ. બેંક, ગાંધીનગર	52,949,964.60	
300,000.00	૫	કોર્પોરેશન બેંક, માણસા	1,471,572.00	
9,018,645.87	૬	ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ., અમદાવાદ	8,591,072.75	
848,980.29	૭	ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ., અમદાવાદ (RTGS)	1,431,450.44	
80,446.54	૮	ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ., અમદાવાદ (Aadhaar)	354,550.12	
453,117.59	૯	ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ., અમદાવાદ (CSGL)	432,793.02	
32,345.00	૧૦	ધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ., હેડ ઓફિસ, આશ્રમ રોડ, અમદાવાદ	487,482.00	
5,416.35	૧૧	ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ., મહેસાણા	5,416.35	
<b>64,532,787.89</b>		<b>કુલ સરવાળો A/1</b>	<b>123,811,046.36</b>	
		<b>A/2</b>		
11,113,813.58	૧	યસ બેંક, ગાંધીનગર	22,741,000.73	
500,000.00	૨	એક્સીસ બેંક, માણસા	4,116,542.00	
1,424,315.27	૩	એચ. ડી. એફ. સી. બેંક લિ., અમદાવાદ	5,696,626.77	
8,244,663.78	૪	આઈ.સી.આઈ.સી.આઈ. બેંક લિ., માણસા	7,285.57	
7,092.67	૫	ધી મહેસાણા અર્બન કો. ઓપ. બેંક લિ., માણસા	5,000,000.00	
<b>21,289,885.30</b>		<b>કુલ સરવાળો A/2</b>	<b>37,561,455.07</b>	
<b>85,822,673.19</b>		<b>કુલ સરવાળો A/1+A2</b>	<b>161,372,501.43</b>	
		<b>B. બચત ખાતે</b>		
		<b>C. અન્ય બેંકમાં મૂકેલ મુદતી થાપણો</b>		
45,000,000.00	૧	સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, માણસા (ગાંધીનગર રોડ શાખા)	45,000,000.00	
19,900,000.00	૨	બેંક ઓફ બરોડા, માણસા	19,900,000.00	
19,000,000.00	૩	કોર્પોરેશન બેંક, માણસા	19,000,000.00	
0.00	૪	આઈ.ડી.બી. આઈ. બેંક, ગાંધીનગર	10,000,000.00	
400,000.00	૫	ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ., અમદાવાદ (M.A.Scheme)	400,000.00	
45,000,000.00	૬	ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લિ., અમદાવાદ	45,000,000.00	
35,000,000.00	૭	ધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ. હેડ ઓફિસ, આશ્રમ રોડ, અમદાવાદ	35,000,000.00	
30,000,000.00	૮	એચ. ડી. એફ. સી. બેંક, માણસા	30,000,000.00	
19,900,000.00	૯	આ.સી.આઈ.સી. આઈ. બેંક, માણસા	19,900,000.00	
0.00	૧૦	એક્સીસ બેંક, માણસા	20,505,934.00	
25,000,000.00	૧૧	ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓપ. બેંક લિ. હેડ ઓફિસ, આશ્રમ રોડ, અમદાવાદ	25,000,000.00	
0.00	૧૨	ધી મહેસાણા અર્બન કો. ઓપ. બેંક લિ., માણસા	20,000,000.00	
69,980,787.00	૧૩	ધી માધુપુરા મર્કન્ટાઇલ કો. ઓપ. બેંક લિ., હેડ ઓફિસ, અમદાવાદ	68,980,787.00	
<b>309,180,787.00</b>		<b>કુલ સરવાળો</b>	<b>358,686,721.00</b>	
<b>32,500,000.00</b>		<b>D. ટૂંકી મુદત અને કોલ ડિપોઝીટ</b>	<b>0.00</b>	
		<b>E. રોકાણો</b>		
<b>464,856,445.00</b>	૧	ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા સિક્યોરીટીઝ	<b>650,694,545.00</b>	
		ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા સિક્યોરીટીઝ		433,029,125.00
		સ્ટેટ ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ		168,297,320.00
		ટી બિલ્સ		49,368,100.00
<b>16,500,000.00</b>	૨	સી. આર. બી. કેપીટલ માર્કેટ્સ લિ.	<b>16,500,000.00</b>	
<b>645,000.00</b>	૩	અન્ય સહકારી સંસ્થાઓના શેર્સમાં રોકાણ	<b>645,000.00</b>	
		ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ., મહેસાણા	640,000.00	
		ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ., અમદાવાદ	5,000.00	
<b>482,001,445.00</b>		<b>કુલ સરવાળો</b>	<b>667,839,545.00</b>	
<b>909,504,905.19</b>		<b>કુલ રોકાણો (A+B+C+D+E)</b>	<b>1,187,898,767.43</b>	

## Loans & Advances - લોન અને લોન-ધિરાણો

અ.નં.	લોન-ધિરાણનાં પ્રકાર	તા.૩૧-૦૩-૨૦૨૦		તા.૩૧-૦૩-૨૦૨૧	
		ખાતા ની સંખ્યા	રકમ ₹	ખાતા ની સંખ્યા	રકમ ₹
<b>અ</b>	<b>ટૂંકી મુદતની લોન-ધિરાણ</b>				
	અન-સિક્યોર્ડ ટૂંકી મુદતની લોન-ધિરાણ				
	1 કેશ-કેડીટ	8	177,497.06	3	96,015.06
	<b>કુલ અન-સિક્યોર્ડ ટૂંકી મુદતની લોન-ધિરાણ</b>	<b>8</b>	<b>177,497.06</b>	<b>3</b>	<b>96,015.06</b>
	સિક્યોર્ડ ટૂંકી મુદતની લોન-ધિરાણ				
	1 માલ તારણ (PLD)	22	65,783,480.00	16	102,557,108.15
	2 હાઇપોથીકેશન (HPC)	284	333,268,816.15	238	296,520,028.71
	3 ફિક્ષ ડિપોઝીટ સામે લોન-ધિરાણ	33	4,945,311.00	23	4,781,181.77
	4 ગોલ્ડ સામે લોન-ધિરાણ	0	0.00	0	0.00
	5 કરન્ટ ઓવર ડ્રાફ્ટ	5	293,832.60	0	0.00
	6 ફિક્ષ ડિપોઝીટ ઓવર ડ્રાફ્ટ	104	54,103,878.80	82	47,088,955.24
	7 હાઇપોથીકેશન મોર્ગેજ (HPM)	35	78,710,343.53	25	59,600,437.60
	8 ફેસ્ટીવલ એડવાન્સ	20	323,500.00	14	248,000.00
	9 ગોલ્ડ લોન બુલેટ	321	23,667,304.00	243	19,495,453.60
	10 એન. એસ.સી. લોન (NSC)	0	0.00	0	0.00
11 મોર્ગેજ ટર્મ કેશ કેડીટ	11	52,425,424.20	11	51,647,608.33	
<b>કુલ સિક્યોર્ડ ટૂંકી મુદતની લોન-ધિરાણ</b>	<b>835</b>	<b>613,521,890.28</b>	<b>652</b>	<b>581,938,773.40</b>	
<b>કુલ ટૂંકી મુદતની લોન-ધિરાણ</b>	<b>843</b>	<b>613,699,387.34</b>	<b>655</b>	<b>582,034,788.46</b>	
<b>બ</b>	<b>મધ્યમ મુદતની લોન-ધિરાણ</b>				
	અન-સિક્યોર્ડ મધ્યમ મુદતની લોન-ધિરાણ				
	1 આત્મનિર્ભર યોજના લોન - 0૧	0	0.00	228	22,694,769.00
	<b>કુલ અન-સિક્યોર્ડ મધ્યમ મુદતની લોન-ધિરાણ</b>	<b>0</b>	<b>0.00</b>	<b>228</b>	<b>22,694,769.00</b>
	સિક્યોર્ડ મધ્યમ મુદતની લોન-ધિરાણ				
	1 લોન અગેઇનસ્ટ ગોલ્ડ	5	791,013.00	1	129,214.95
	2 હાથર પરચેઝ (VHP)	37	12,699,751.00	31	26,549,974.00
	3 મશીનરી લોન (ML)	6	7,300,954.22	7	6,854,199.28
	4 આત્મનિર્ભર યોજના લોન - 0૨	0	0.00	35	8,851,990.00
	<b>કુલ સિક્યોર્ડ મધ્યમ મુદતની લોન-ધિરાણ</b>	<b>48</b>	<b>20,791,718.22</b>	<b>74</b>	<b>42,385,378.23</b>
<b>કુલ મધ્યમ મુદતની લોન-ધિરાણ</b>	<b>48</b>	<b>20,791,718.22</b>	<b>302</b>	<b>65,080,147.23</b>	
<b>ક</b>	<b>લાંબી મુદતની લોન-ધિરાણ</b>				
	અન-સિક્યોર્ડ લાંબી મુદતની લોન-ધિરાણ				
	1 લોન ધિરાણ	23	4,636,382.63	18	4,090,774.03
	2 સ્મોલ ટ્રેડર્સ લોન (S.T.Loan)	22	4,833,032.00	22	4,523,891.12
	<b>કુલ અન-સિક્યોર્ડ લાંબી મુદતની લોન-ધિરાણ</b>	<b>45</b>	<b>9,469,414.63</b>	<b>40</b>	<b>8,614,665.15</b>
	સિક્યોર્ડ લાંબી મુદતની લોન-ધિરાણ				
	1 સ્થાવર મિલકત લોન (RAL)	22	37,372,704.00	20	31,592,979.76
	2 એજ્યુકેશન લોન	3	2,388,874.00	3	2,187,619.39
	3 મોર્ગેજ ધિરાણ (MTL)	66	139,855,159.48	63	146,916,492.35
	4 સ્ટાફ હાઉસિંગ લોન (SHL)	4	371,199.00	2	191,845.57
	5 હાઉસિંગ લોન	41	87,036,657.74	40	78,163,316.55
	6 ન્યુ કાર લોન	165	64,262,796.00	156	52,652,260.52
	7 સ્ટાફ લોન	6	347,074.00	5	196,302.31
<b>કુલ સિક્યોર્ડ લાંબી મુદતની લોન-ધિરાણ</b>	<b>307</b>	<b>331,634,464.22</b>	<b>289</b>	<b>311,900,816.45</b>	
<b>કુલ લાંબી મુદતની લોન-ધિરાણ</b>	<b>352</b>	<b>341,103,878.85</b>	<b>329</b>	<b>320,515,481.60</b>	
<b>એકંદર કુલ લોન-ધિરાણ</b>	<b>1243</b>	<b>975,594,984.41</b>	<b>1286</b>	<b>967,630,417.29</b>	

Interest Rate on Loans & Advances From 01/03/2021					
No.	Loan And Advances Type	Product	Interest Rate	Remark	
<b>A</b>	<b>Short Term Loan &amp; Advances</b>				
	<b>Unsecured Short Term Loan &amp; Advances</b>				
	1	Cash Credit	22	11.50 %	2 % Penal
	<b>Secured Short Term Loan &amp; Advances</b>				
	1	Pledge	24	10.90 %	2 % Penal
	2	Hypothecation	23	10.90 %	2 % Penal
	3	Fix Deposit Over Draft Loan	31		
		- Own FDR		1 % above Deposit Rate	2 % Penal
	4	- Third Party FDR		2 % above Deposit Rate	2 % Penal
		Current Over Draft Against FDR	26		
5	- Own FDR		1 % above Deposit Rate	2 % Penal	
	- Third Party FDR		2 % above Deposit Rate	2 % Penal	
6	Fix Deposit Over Draft	21			
	- Own FDR		1 % above Deposit Rate	2 % Penal	
7	- Third Party FDR		2 % above Deposit Rate	2 % Penal	
	Hypothecation Mortgage	33	10.90 %	2 % Penal	
8	Festival Loan (Staff)	32	0.00 %	0.00	
9	Gold Loan Bullet	117	10.00%	2 % Penal	
10	N.S.C. -K.V.P. Loan	29	9.50 %	2 % Penal	
	Mortgage Cash Credit	123	10.90 %	2 % Penal	
<b>B</b>	<b>Medium Term Loan &amp; Advances</b>				
	<b>Unsecured Medium Term Loan &amp; Advances</b>				
	<b>Secured Medium Term Loan &amp; Advances</b>				
	1	Loan Against Gold	52	10.00 %	2 % Penal
2	Vehicle Hypothecation	41	10.90 %	2 % Penal	
3	Machinery Loan	43	10.90 %	2 % Penal	
<b>C</b>	<b>Long Term Loan &amp; Advances</b>				
	<b>Unsecured Long Term Loan &amp; Advances</b>				
	1	Loan (Loan To Salaries Persons)	44	11.50 %	2 % Penal
	2	Small Traders Loan	45	11.50 %	2 % Penal
	<b>Secured Long Term Loan &amp; Advances</b>				
	1	Real Assets Loan	42	10.90 %	2 % Penal
	2	Education Loan	122	9.50 %	2 % Penal
	3	Mortgage Term Loan	106	10.90 %	2 % Penal
	4	Staff Housing Loan	47	9.00 %	0.00
	5	Housing Loan	55	9.00 %	2 % Penal
6	New Car Loan	116	9.00 %	2 % Penal	

## બેંકના સભાસદો અને ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓ

- ફિક્ષ કિપોઝીટ તથા રિકરીંગ કિપોઝીટ ઉપર આકર્ષક વ્યાજના દર.
- સીનીયર સીટીઝનને વધારાના વ્યાજનો લાભ.
- બચત ખાતા ઉપર દૈનિક ધોરણે 3.00% લેખે વ્યાજ આપવામાં આવે છે.
- ₹ ૫ લાખ સુધીની કિપોઝીટ વિમાથી સુરક્ષિત.
- બેંકની ફિક્ષ કિપોઝીટ સામે ત્વરિત નજીવા વધારાના વ્યાજના દરે લોનની સગવડ.
- ઝડપી ઇંડ ટ્રાન્સફર માટે RTGS/NEFTની સુવિધા.
- ખાતેદારોને CTS-2010 સ્ટાન્ડર્ડ મુજબની ચેકબુક આપવામાં આવે છે.
- બેંકની તમામ શાખાઓ કોમ્પ્યુટરાઈઝ અને CBS ટેકનોલોજીની સેવાથી કાર્યરત છે.
- સભાસદને ₹ ૩ લાખના અકસ્માત વિમાનો લાભ આપવામાં આવે છે.
- બેંકની માર્કેટ ચાર્જ અને બજાર શાખામાં લોકરની સુવિધા.
- બેંક દ્વારા પ્રધાન મંત્રી વિમા સુરક્ષા યોજનાનો લાભ આપવામાં આવે છે.
- ખાતામાં વારસદાર નોંધણી કરવાની સુવિધા.
- E-payment સરકારી તમામ ટેક્ષ ચૂકવણી માટેની સુવિધા.

**“Good Banking is produced not by good laws, but by good bankers.”**

**“ગુડ બેંકિંગ સારા કાયદા દ્વારા નહિ, પરંતુ સારા બેંકરો દ્વારા બનાવવામાં આવે છે.”**



**THE MANSA NAGARIK SAHAKARI BANK LTD**  
Market Yard, Mansa , Dist. Gandhinagar 382845.  
**CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED ON 31.03.2021**

Sr. No.	Particulars	31-03-2020		31-03-2021	
		Amount ₹	Amount ₹	Amount ₹	Amount ₹
<b>A</b>	<b>CASH FLOW FROM OPERATING ACTIVITIES</b>				
	<b>Net Profit after Tax</b>		<b>1,65,00,000.00</b>		<b>2,37,00,000.00</b>
	<b>Adjustments For :</b>				
1	Depreciation	16,89,482.40		19,68,661.47	
2	BDDR	27,18,962.58		34,45,633.11	
3	Std Asset Reserve	-		-	
4	Dividend	(750.00)		-	
5	Deferred tax Liability	(2,89,600.00)		(2,40,300.00)	
6	Loss on sale of Securities	6,34,000.00		-	
7	Premium amortisation on Govt Securities'	-		-	
8	Profit on Sale of Securities	(2,20,000.00)		-	
9	Loss ( Profit ) on sale of Asset	(1,12,367.00)		-	
10	Provision ( Return Back ) for Investment Depreciation	-		-	
11	Provision ( Return Back ) for OIR Reserve	-		-	
12	Direct Tax Paid/ Reserve	86,10,570.00	<b>1,30,30,297.98</b>	89,36,616.00	<b>1,41,10,610.58</b>
			<b>2,95,30,297.98</b>		<b>3,78,10,610.58</b>
	<b>Operating Profit Before Change in Operating Assets and Liabilities</b>				
	<b>Adjustments for :</b>				
1	Recovery from amount w/off				
2	Current Assets ( other then Advance tax )	(2,08,81,332.10)		(1,75,86,911.90)	
3	Current Liability	72,57,126.85		14,74,158.80	
4	Movement in Borrowings ( Net )	(5,53,46,166.30)		-	
5	Movement in Deposit ( Net )	10,92,68,583.26		25,19,20,186.15	
6	Branch Adjustment Account	4,91,45,710.40		(25,000.00)	
7	Interest Payable	(3,14,488.60)		(19,13,638.00)	
8	Movement in Advances ( Net )	(2,33,04,296.06)	<b>6,58,25,137.45</b>	79,64,567.12	<b>24,18,33,362.17</b>
9	Cash Generated from Operations		<b>9,53,55,435.43</b>		<b>27,96,43,972.75</b>
10	Direct Tax Paid		(1,00,00,000.00)		(1,00,00,000.00)
11	Cash Generated from Operations		<b>8,53,55,435.43</b>		<b>26,96,43,972.75</b>
<b>B</b>	<b>Cash Flow From Investment Activities</b>				
1	Dividend	750.00			
2	Profit on Sale of Securities	2,20,000.00	-	-	
3	Loss on Sale of Securities	(6,34,000.00)	-	-	
4	Profit on Sale of Assets	1,12,367.00	-	-	
5	Purchase of Investments ( NET )	(26,11,908.00)		(23,63,43,943.00)	
6	Sale of Investments	-		-	
7	Sale of Fixed Assets	1,28,500.00	-	-	
8	Purchase of Fixed Assets	25,29,653.10	(2,54,637.90)	14,32,714.47	(23,49,11,228.53)
9	Net Cash Flow From Investing Activities		<b>(2,54,637.90)</b>		<b>(23,49,11,228.53)</b>
<b>C</b>	<b>Cash From Financing Activities</b>				
1	Interest overdue Reserve	15,79,660.90		(8,89,372.24)	
2	Decrease in Nominal Fees	-	-	-	-
3	Proceeds from Issue of Share Capital	20,93,850.00		21,45,775.00	
4	Dividend Paid	(73,71,231.00)		-	
5	Movement in Reserve Fund	33,13,212.00	(19,64,169.00)	66,74,547.00	88,20,322.00
6	Net Cash From Financing Activities	-	<b>(19,64,169.00)</b>	-	<b>88,20,322.00</b>
	<b>Net Increase in Cash &amp; Cash Equivalents</b>		<b>8,31,36,628.53</b>		<b>4,35,53,066.22</b>
	<b>Cash &amp; Cash Equivalent at the Beginning</b>		<b>10,19,77,623.26</b>		<b>11,26,43,579.19</b>
	<b>Cash &amp; Cash Equivalent at the End</b>		<b>11,26,43,579.19</b>		<b>19,38,52,545.43</b>

**Notes to cash Flow Statement :-**

a. Cash and cash equivalents reflects the following balances:-

	31-03-2020	31-03-2021
a) Cash on hand and with Reserve Bank of India, State Bank of India, State Co-operative Bank and Central Co-operative Bank	9,13,53,693.89	15,62,91,090.36
b) Balance with other banks	2,12,89,885.30	3,75,61,455.07
<b>Total</b>	<b>11,26,43,579.19</b>	<b>19,38,52,545.43</b>

b. The above Cash Flow Statement has been prepared under the "Indirect Method" as set out in the Accounting Standard - 3 on Cash Flow Statements.

c. Previous year's figures have been regrouped wherever necessary to confirm to this year's classification.

d. Figures in bracket indicate cash outflows.

**AS PER OUR REPORT OF EVEN DATE ATTACHED FOR, M/s URVISH PATEL & CO.**

CHARTERED ACCOUNTANTS

Firm No. :- 124710W

(CHAIRMAN)

(VICE CHAIRMAN)

(URVISH R. PATEL)

PARTNER

M.NO. 115833 PANEL NO. : 79

(M.D./C.E.O./G.M.)

PANEL NO. : 79

UDIN: -21115833AAAAEH1446

PLACE: Ahmedabad DATED: -01/09/2021

## **SIGNIFICANT ACCOUNTING POLICIES FOR THE YEAR ENDED 31<sup>ST</sup> MARCH, 2021**

### **1. GENERAL**

The Financial Statements are prepared under the historical cost convention. They conform to Generally Accepted Accounting Principles (GAAP) in India, which comprises the statutory provisions, Gujarat Co-operative Societies Act, 1961, Reserve Bank of India (RBI) guidelines, Accounting Standards / guidance notes issued by the Institute of Chartered Accountants of India (ICAI) to the extent applicable and generally the practices prevalent in Banking Industry in India.

The materiality aspect has been taken into consideration while making classification of advances, borrowings, deposits, provisioning on advances and other assets, liabilities, income and expenses.

### **2. USE OF ESTIMATES**

The preparation of financial statements requires the management to make estimates and assumptions considered in the reported amounts of assets and liabilities as on the date of the financial statements and the reported income and expenses during the reporting period. Management believes that the estimates used in the preparation of the financial statements are prudent and reasonable. Future results could differ from these estimates. Any revision to the accounting estimation is recognized prospectively in the current and future periods.

### **3. ADVANCES**

a. The bank has followed prudential norms formulated by Reserve Bank of India as to Asset Classification, Income recognition and Provisioning of advances and has accordingly classified its advances into Standard, Sub-standard, Doubtful and Loss Assets. The bank has made the necessary provision in respect of Standard, Sub-standard, Doubtful and Loss Assets as per the directives of Reserve Bank of India issued from time to time.

b. The overdue interest in respect of advances is provided separately under "Overdue Interest Receivable (NPA)" as per the directive issued by the Reserve Bank of India.

c. The provision made for standard advances (performing) in terms of RBI guidelines is however, included in "Contingent Provision Standard Assets".

d. Additional provision carried in accounts over and above requirement under the prudential norms prescribed by the Reserve Bank of India, which can be considered as earmarked reserve is as follows:

1. Bad & doubtful debts provision for rural advances.

### **4. PROPERTY PLANT AND EQUIPMENTS AND DEPRECIATION**

a. Property Plant and Equipment other than land and Building are stated at their historical cost less accumulated depreciation. Cost includes incidental expenses incurred on acquisition of assets. Land and Building are stated at cost amount less accumulated depreciation.

#### **b. Impairment of Assets:**

At each Balance Sheet, the bank assesses whether there is any indication that an asset may be impaired. If any indication exists, the recoverable amount of the assets is estimated. An impairment loss is recognized immediately, whenever the carrying amount of an asset exceeds its recoverable amount. The recoverable amount is the greater of net selling price and value in use. In assessing value in use, estimated future cash flows are discounted to their present value based on appropriate discount factor.

c. Property Plant and Equipment's other than land and Building are stated as their historical cost less accumulated depreciation. Cost includes incidental expenses incurred on acquisition of assets. Land and Building are stated at cost amount less accumulated depreciation.

d. Property Plant and equipment (including land, wherever the cost of land is not segregated) are depreciated on written down value method rate applicable as per bank's policy.

e. Depreciation on Fixed Assets purchased during the year is charged for the entire year if the assets are purchased and retained for 180 days or more. Otherwise, it is charged @ 50% of the normal rate. No depreciation is charged on fixed assets sold during the year. Equivalent amount of depreciation on revalued amount is charged to Revaluation Reserve as per consistent practice followed from year to year.

### **5. INVESTMENTS**

a) The entire Investment Portfolio of the bank is classified, in accordance with the Reserve Bank of India's guidelines, into three categories:

i. Held to maturity comprising investments acquired with the intention to hold them till maturity.

ii. Held for trading comprising investments acquired with the intention to trade.

iii. Available for Sale comprising of investments which are not classified in above two categories.

b) Investments classified as Held to Maturity are carried at the acquisition cost, if it is more than face value; the premium is amortized over the period remaining to maturity.

c) Investments classified as Held for Trading and available for sale and marked to market scrip wise and the resultant diminution is recognized in Profit & Loss Account.

d) Profit or loss on sale of investment classified as Held for Trading and available for sale is recognized in the Profit and Loss Account.

e) Profit or loss on sale of investment classified as held to maturity is recognized in Profit & Loss Account and Profit is appropriated (net of applicable taxes and transfer to statutory reserve) to Capital Reserve.

f) Brokerage/Commission/Securities transaction tax received/paid on subscriptions is adjusted from the cost.

g) Broken period interest paid/received on investment is treated as interest expense /income and is excluded from cost/sales consideration.

h) Investments are classified as performing and non-performing, based on the guidelines issued by the RBI.

### **6. REVENUE RECOGNITION**

Income / Expenditures are accounted for on accrual basis except for:

a) Interest and other income on NPA are accounted as per RBI guidelines.

b) Insurance premium.

c) Net profit/loss on sale of securities is recognized at the time of sales.

### **7. EMPLOYEE BENEFITS**

a. Contribution to the Provident Fund is made at predetermined rate and charged to the Profit and Loss Account.

b. The Bank makes contribution towards gratuity to a fund administered by LIC of India as per Accounting Standard-15, "Employee Benefits" issued by the Institute of Chartered Accountants of India.

- c. Leave encashment liability is accounted for on accrual basis and charged to Profit & Loss Account.  
d. Salaries and other benefits are accrued in the year in which the services are rendered by the employees and charged to the Profit and Loss Account.

## 8. TAXES ON INCOME

Provisions for tax comprises of current tax for the period determined in accordance with the relevant laws and deferred tax debit or credit reflecting the tax effect of timing difference between accounting income and taxable income for the period, in conformity with the Accounting Standard (AS)-22: Accounting for Taxes on Income issued by the ICAI. The deferred tax debit or credit and the corresponding deferred tax liabilities or assets are recognized using the tax rates prevailing at the balance sheet date. Deferred tax assets are not recognized unless there is virtual certainty that sufficient future taxable income will be available against which such deferred tax assets will be realized.

## 9. PROVISION, CONTINGENT LIABILITIES AND CONTINGENT ASSETS

a. In conformity with AS-29 "Provision, Contingent Liabilities and Contingent Assets" issued by the Institute of Chartered Accountants of India, the Bank recognizes provision only when it has a present obligation as a result of a past event, it is probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation, and when a reliable estimate of the amount of the obligation can be made.

b. No provision is recognized for:

- Any possible obligation that arises from past events and the existence of which will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events not wholly within the control of the Bank. Or
- Any present obligation that arises from past events but is not recognized because:
  - It is not probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation or
  - Reliable estimate of the amount of obligation cannot be made.

Such obligations are recorded as Contingent Liabilities. These are assessed at regular intervals and only that part of the obligation for which an outflow of resources embodying economic benefits is probable, is provided for, except in the extremely rare circumstances where no reliable estimate can be made.

c. Contingent Assets are not recognized in the financial statement as this may result in the recognition of income that may never be realized.

## 10. NET PROFIT

The net profit disclosed in the Profit and Loss account is arrived at after making-

- Provision for taxes.
- Provision for Non-Performing Assets/Standard Advances as per RBI guidelines.
- Adjustment in the value of investment.
- Provision for overdue interest.
- Provision for special reserve as per section 36 (1) (vii) of Income Tax Act.
- Other necessary and usual provisions.

## 11. CASH FLOW STATEMENT

Cash Flow statement has been worked out as per Indirect Method specified under Accounting Standard – 3, "Cash Flow Statement" issued by the Institute of Chartered Accountants of India.

## 12. CONTINGENCIES AND EVENT OCCURRING AFTER THE BALANCE SHEET DATE

Material adjusting events (that provides evidence of condition that existed at the balance sheet date) occurring after the balance sheet date are recognized in the financial statement. Non-adjusting events (that are indicative of condition that arose subsequent to the balance sheet date) occurring after the balance sheet date represent material change and commitment affecting the financial position are disclosed in the reports of the board of Directors and Hisab Tapasni yadi shero 1 & 2.

## 13. EARNING PER SHARE

Earnings per share (EPS) is computed by dividing net profit after tax by weighted average number of equity shares outstanding for the year.

### તા. ૩૧.૦૩.૨૦૨૧ના રોજ એન.પી.એ.(N.P.A.)ની સ્થિતિ અને તેની સામે કરેલ જોગવાઈ(પ્રોવિઝન)ની માહિતી (રકમ ₹ લાખમાં)

વર્ગીકરણ	ઘિરાણ		કરવા પાત્ર જોગવાઈ રકમ	કરેલ જોગવાઈ રકમ
	ખાતાની સંખ્યા	રકમ		
સ્ટાન્ડર્ડ એસેટ	૧૨૫૦	૮૩૩૧.૨૭	૩૭.૩૩	૫૨.૦૦
સબ સ્ટાન્ડર્ડ એસેટ	૨૪	૨૨૭.૦૫	૫૨.૬૯	૧૧૨.૧૬
ડાઉટ ફુલ એસેટ-૧	૮	૧૧૦.૯૬	૪૧.૫૩	
ડાઉટ ફુલ એસેટ-૨	૧	૩.૯૨	૧.૭૧	
ડાઉટ ફુલ એસેટ-૩	૧	૨.૦૦	૨.૦૫	
લોસ એસેટ	૪	૧.૧૧	૧૪.૧૮	
<b>કુલ</b>	<b>૧૨૮૮</b>	<b>૮૬૭૬.૩૧</b>	<b>૧૪૯.૪૯</b>	<b>૩૮૭.૮૧</b>

### તા. ૩૧.૦૩.૨૦૨૧ના રોજની પ્રાયોરીટી સેક્ટરમાં કરેલ ઘિરાણની માહિતી (રકમ ₹ લાખમાં)

વર્ગીકરણ	તા.૩૧.૦૩.૨૦૨૦		તા.૩૧.૦૩.૨૦૨૧	
	રકમ	ટકાવારી %	રકમ	ટકાવારી %
પ્રાયોરીટી સેક્ટર	૬૩૩૪.૪૬	૬૪.૯૨%	૬૨૫૪.૯૧	૬૪.૬૪%
વિકર સેક્ટર	(૮૧૬.૫૧)	(૧૨.૮૮%)	(૭૮૨.૪૯)	(૧૨.૫૧%)
નોન પ્રાયોરીટી સેક્ટર	૩૪૨૧.૪૮	૩૫.૦૮%	૩૪૨૧.૩૯	૩૫.૩૬%
<b>કુલ</b>	<b>૯૭૫૫.૬૪</b>	<b>૧૦૦.૦૦ %</b>	<b>૯૬૭૬.૩૦</b>	<b>૧૦૦.૦૦%</b>

# THE MANSA NAGARIK SAHAKARI BANK LTD., MANSA

## NOTES ON ACCOUNTS FOR THE YEAR 2020-2021:

### 1. Disclosure as per RBI circular No. DBOD.BP.BC. NO. 8/21.04.2018/2014-18 DATED JULY 1, 2014

S. No.	Particulars	₹. in Lakh)	
		31st March, 2020	31st March, 2021
i) & ii)	Capital to Risk Weighted Asset Ratio (CRAR)	16.05 %	16.81 %
iii)	Investments		
	SLR Investments		
	a. Book Value	4648.56	6506.95
	b. Face Value	4672.28	6572.28
	c. Market Value	4999.72	6847.76

### Details of Issuer composition of non- SLR investments

₹. In lakh)

No.	Issuer	Amount	Extent of below investment grade securities	Extent of unrated securities	Extent of unlisted securities
1.	PSU's				
2.	FI's	165.00		165.00	165.00
3.	Public Sector Banks				
4.	Mutual Funds				
5.	Others	706.26		706.26	689.81
6.	Provision held towards depreciation#	(874.00)		(874.00)	(874.00)

### Non- performing non- SLR Investments.

₹. In lakh)

Particulars	Amount
Opening Balance	871.26
Addition during the year since 1 <sup>st</sup> April	0.00
Reduction during the above period	17.00
Closing Balance	854.81
Total Provisions Held#	874.00

#Excess Provision of ₹ 19.19 lakh (₹ 874 lakh-854.81 lakh) held by the bank as on 31<sup>st</sup> March, 2021.

S. No.	Particulars	₹. in Lakh)	
		31st March, 2020	31st March, 2021
iv)	<b>Advances against: -</b>		
	Real Estate-	373.73	315.93
	Construction business-	0.00	0.00
	Housing-	870.37	781.63
v)	Advances against shares & debentures	0.00	0.00
vi)	<b>Advances to Directors, their relatives, companies / firms in which they are interested.</b>	0.00	0.00
	a. Fund Based	0.00	0.00
	b. Non-Fund Based (Guarantees, L/C etc.)	0.00	0.00
vii)	<b>Cost of Deposits</b>		
	Average Cost of Deposits	6.27 %	5.74 %
viii)	<b>NPAs</b>		
	a. Gross NPAs	517.41	345.04
	b. Net NPAs	0.00	0.00
ix)	<b>Movement of NPAs</b>		
	Opening Balance	289.63	517.41
	Reduction During the Year	489.45	750.53
	Additions During the Year	717.23	578.16
	Closing Balance (Gross NPA)	517.41	345.04
	Net NPA	0.00	0.00

	<b>Profitability</b>		
	a.Total Income as a percentage of Working Funds	12.14 %	12.96 %
	b.Interest Income as a percentage of Working Funds	8.17 %	7.34 %
	c. Non-Interest Income as a percentage of Working Funds	0.07 %	0.37 %
	d.Operating Profit as a percentage of Working Funds	1.43 %	3.00 %
	e.Return of Assets	0.85 %	1.08 %
	f. Business Per Employee [(Deposit + Advances) / No. of Employees]	626.22	798.36
	g.Profit Per Employee	3.93	6.58
xi)	<b>Provisions made</b>		
	a. Towards NPAs	203.19	227.94
	b. Towards depreciation on investments.	874.00	874.00
	c. Towards standard assets	52.00	52.00
xii)	<b>Movement in Provisions</b>		
	a. Towards NPAs	21.26	24.75
	b. Towards Depreciation on investments	0.00	0.00
	c. Towards Standard Assets	0.00	0.00
xiii)	<b>Foreign currency assets &amp; liabilities</b>	NIL	NIL
xiv)	<b>Payment of Insurance Premium to the DICGC including arrears, if any,</b>		
	Premium paid on Dt. 15.04.2019 / 06/05/2020	9.25	10.05
	Dt. 15.10.2019 / 07/04/2021	9.43	11.59
	(No amount is outstanding towards premium of DICGC)		
xv)	<b>Penalty imposed by Reserve Bank of India</b>	NIL	NIL
	<b>Restructured Accounts</b>		
	Std. Adv. Restructured	NIL	NIL
	Sub. Std. Adv. Restructured	NIL	NIL
	Doubtful Adv. Restructured	NIL	NIL
	<b>Total Adv. Restructured</b>	<b>NIL</b>	<b>NIL</b>
xvii)	Fixed Assets- Valuation/ Revaluation: The revaluation of the Assets was done on March 2011 and the depreciation is written off in 10 Years from the Succeeding year of Revaluation done. During the year bank has not revalued its fixed assets. The Bank is following cost model as specified in Accounting Standard-10, "Property Plant & Equipment's".		

## 2. CONTINGENT LIABILITIES

(a) Disclosure in terms of RBI Circular No. DBOD.NO. DEAF CELL.BC. 114/30.01.002/2013-14 dated 27.05.2014  
(₹. in lakh)

<b>Particulars</b>	<b>31.03.2020</b>	<b>31.03.2021</b>
Opening balance of amounts transferred to DEAF	32.45	32.45
Add: Amounts transferred to DEAF during the year	0.00	0.68
Less: Amounts reimbursed by DEAF towards claims	0.00	0.00
Closing balance of amounts transferred to DEAF	32.45	33.13

## 3. As per Reserve Bank of India (RBI) guidelines on Accounting Standard (AS)-17 "Segment Reporting", business segment has been Recognized as the 'Primary Reporting Segment'. The business segment comprises of "Treasury", "Retail Banking" and "Other Banking Operations". The disclosure in terms of AS-17 is as under:

(₹. in lakh)

Sr. No.	Particulars	Treasury Operations	Retail Banking	Wholesale Banking	Un-allocable	Total
i.	Segment Result	-62.47	106.86	0.00	192.61	237
ii.	Extra Ordinary profit/ loss	-	-	-	-	-
iii.	Other information	-	-	-	-	-
iv.	Segment Assets	7368.20	19978.40	-	1674.38	29020.98
v.	Segment Liabilities*	7368.20	19978.40	-	1674.38	29020.98

The bank does not have any operations/activities which can be classified as 'Geographical Segment' as "Secondary Reporting Segment" in terms of AS-17.	
Treasury Operations: Treasury operations for the purposes of Segment Reporting under AS-17 "Segment Reporting" consist of the entire investment portfolio i.e. dealing in government and other securities and Money market operations, if any. The revenue of the treasury segment primarily consists of interest income on the investment portfolio.	
	Retail Banking: Retail banking operations for the purposes of Segment Reporting under AS-17 "Segment Reporting" consist of exposures to individual borrower or group of borrowers which does not exceed ₹ 5.00 crores.
Allocation of Segment Cost:	
Expenses that are directly attributable to a particular segment have been allocated to the respective segment	
Expenses that are not directly attributable to a particular segment have been allocated either i. In proportion of Business carried out/managed or ii. In approximate proportion of the segment result of a particular segment based on the last year trend or iii. On the basis of average cost of the business of the particular segment.	
Unallocated Expenses, Unallocated Assets and Unallocated Liabilities: The expenses, assets and liabilities which cannot be allocated to a particular segment either directly or as per proportionate attribution have been reported as unallocated expenses, unallocated assets and unallocated liabilities respectively.	
*In absence of specific detailed bifurcation of liabilities assumed for specific segment, segment liabilities have been recognized only to the extent of assets of that particular segment.	

#### 4. Information in terms of Accounting Standards:

##### 4.1 Accounting Standard-5 "Net profit or loss for the period, prior period item and change in accounting policies"

There were no material prior period items required to be disclosed under AS-5.

##### 4.2 Accounting Standard-15 "EMPLOYEE BENEFITS"

The disclosure in case of defined benefit plans as per Accounting Standard (AS)-15 "Employee Benefits" is as under:

###### 01. Gratuity policy:

	31.03.2020	31.03.2021
Discount Rate as per AS-15	7.00 %	7.00 %
Salary Escalation	7.00 %	7.00 %

###### 02. Table Showing changes in present value of Obligation as on 31/03/2021.

Particulars	F.Y. 2020-2021
Present value of obligations as at beginning of year	9167729.00
Interest cost	641741.00
Current Service Cost	451469.00
Benefits Paid	0.00
Actuarial (gain)/ loss on obligations	(21764.00)
Present value of obligations as at end of year	10239175.00

###### 03. Table showing changes in the fair value of plan assets as on 31/03/2021.

Particulars	F.Y. 2020-2021
Fair value of plan assets at beginning of year	14199862.61
Expected return on plan assets	(381910.61)
Contributions	0.00
Benefits Paid	0.00
Actuarial gain/(loss) on Plan assets	Nil
Fair value of plan assets at the end of year	10817952.00

###### 04. Table showing fair value of plan assets as on 31/03/2021.

Particulars	F.Y. 2020-2021
Fair value of plan assets at beginning of year	14199862.61
Actual return on plan assets	(3381910.61)
Contributions	0.00
Benefits Paid	0.00
Fair value of plan assets at the end of year	10817952.00
Funded status	578777.00
Excess of Actual over estimated return on plan assets (Actual rate of return=Estimated rate of return as ARD falls on 31 <sup>st</sup> March)	Nil

**05. Actuarial Gain/Loss recognize as on 31/03/2021.**

Particulars	F.Y. 2020-2021
Actuarial (gain)/ loss on obligations	21764.00
Actuarial (gain)/ loss for the year - plan assets	Nil
Actuarial (gain)/ loss on obligations	(21764.00)
Actuarial (gain)/ loss recognized in the year	(21764.00)

**06. The amounts to be recognized in the balance sheet and statements of profit and loss. as on 31/03/2021**

Particulars	F.Y. 2020-2021
Present value of obligations as at the end of year	10239175.00
Fair value of plan assets as at the end of the year	10817952.00
Funded status	578777.00
Net asset/(liability) recognized in balance sheet	578777.00

**07. Expenses Recognized in statement of Profit and loss as on 31/03/2021.**

Particulars	F.Y. 2020-2021
Current Service cost	451469.00
Interest Cost	641741.00
Expected return on plan assets	(3381910.61)
Net Actuarial (gain)/ loss recognized in the year	(21764.00)
Expenses recognized in statement of Profit and loss	4453357.00

Note: Previous year figures have not been given as the same are not available on bank's record.

**4.3 Accounting Standard 18 – Related party disclosures.**a) Key Management Personnel

Disclosure under Accounting Standard 18 issued by the Institute of Chartered Accountants of India read with RBI guidelines, to the extent applicable, is given below:  
(₹. in Lakh)

Sr. No.	Particulars	Current Year 2019-2020	Previous Year 2020-2021
1	Name	KAMLESH J. SHAH (CEO)	
2	Remuneration paid (Consolidated Salary & allowance)	5.33	5.71
3	SOD Loan	-	-
4	Bank's contribution towards the Provident Fund	-	-
5	Interest received on SOD Loan	-	-

**4.4 Accounting Standard 20 – Earning Per Share**

(₹. in Lakh)

Particulars	Current Year 2019-2020	Previous Year 2020-2021
Net Profit after tax	165.00	237.00
Weighted Average Number of shares (₹ 25)	2525170	2611001
EPS Basic and Diluted (in ₹)	6.6444	9.2287
Face value (per share in ₹) *	25.00	25.00

**4.5 Accounting Standard 22- Accounting for Taxes on Income**

The Bank has recognized Deferred Tax Assets/Liabilities (DTA/DTL) in accordance with Accounting Standard 22 issued by the Institute of Chartered Accountants of India.

Particular	2019-2020	2020-2021
Deferred tax Liability for the current F.Y. year ended dated 31.03.2021.	-	2,40,300.00

**4.6 Disclosure in respect of provision against contingent liabilities in compliance to AS-29 issued by the Institute of Chartered Accountants of India is as under: -**

Details of Balance in Provisions for Contingent Liability:

(₹. in Lakh)

Particulars	Current Year 2019-2020	Previous Year 2020-2021
Opening Balance	-	-
Additions during the year	-	-
Amounts used during the year	-	-
Unused amount reversed during the year	-	-
Closing Balance	-	-

**Additional Disclosure:**

Provision and Contingencies

(₹. in Lakh)

<b>Break up of 'Provisions and Contingencies' shown under the head Expenditure in Profit and Loss account</b>	<b>Current Year 2019-2020</b>	<b>Previous Year 2020-2021</b>
Provision for depreciation on Investments	0.00	(69.25)
Provision towards NPAs	27.19	34.46
Provision towards Standard Assets	0.00	0.00
Provision made towards Income Tax	102.24	93.35
Provision for Overdue Interest	64.90	56.01
Provision for Special Reserve U/S 36 (1) (vii) of I.T. Act,1961	21.26	24.75

**5. Additional Information of Investments**

(₹. in Lakh)

<b>Sr. No.</b>	<b>Particulars</b>	<b>31-03-2020</b>	<b>31-3-2021</b>
<b>01.</b>	<b>Classification of Investments</b>		
	1. Held to Maturity (HTM)	1454.89	1354.89
	2. Held for Trading (HFT)	0.00	0.00
	3. Available for Sales (AFS)	3365.12	5323.51
	<b>Total Investments</b>	<b>4820.01</b>	<b>6678.40</b>
<b>02.</b>	<b>Composition of Investments</b>		
	<b>A. SLR Investments</b>		
	1. Central Govt. Securities	2865.59	4330.29
	2. State Govt. Securities	1782.97	1682.98
	3. Treasury Bills	0.00	493.68
	<b>Total A. SLR Investments</b>	<b>4648.56</b>	<b>6506.95</b>
	<b>B. Non SLR Investments</b>		
	C.R.B. Capital Markets Ltd.	165.00	165.00
	Shares of Co-operative Bank	6.45	6.45
	<b>Total B. Non SLR Investments</b>	<b>171.45</b>	<b>171.45</b>
	<b>Grand Total Investments (A+B)</b>	<b>4820.01</b>	<b>6678.40</b>
<b>03.</b>	<b>Provision for Depreciation in Value of Investments.</b>		
	Held in Books (IFR+IDR)	102.53	117.16
	Erosion in value of Investments (HTM+AFS)	0.00	(30.75)
	Excess/(Short) Provision	(158.17)	(146.53)

6. Outbreak of COVID-19 pandemic has impacted credit and recovery segments of banking business. Though there has been an impact on recovery, loan default risk has been largely minimized on account of grant of moratorium on repayment of loans and other measures to reduce the interest burden by Reserve Bank of India. Bank has continued its operation through its all branches even during scenario of COVID-19 and with the partial relaxation of lockdown norms by Central and State Government, full-fledged banking operations resumed in most of the branches after following safety norms. As per RBI circular DOR.No.BP.BC.63/21.04.048/2019.20 dated 17<sup>th</sup> April, 2020, during the year the assets classification and provisioning in respect of COVID-19 Regulatory Package is as under:

(₹. in Lakh)

<b>No.</b>	<b>Particular</b>	<b>Amount</b>
01.	Respective amount in SMA/Over Due Categories where the moratorium/deferment was extended	0.00
02.	Out of above (i) amount where assets classification benefits is extended	0.00
03.	Provisions made during Q4 F.Y. 2020 and Q1 F.Y. 2021	0.00
04.	Provisions adjusted during the respective accounting periods against slippage and residual provision.	0.00



7. Inter Branch Adjustment Account is reconciled up to 31<sup>st</sup> March, 2021.
8. Market Value in the case of Central and State Government securities, PSU bonds is determined as per RBI guidelines on the basis of the "Yield to Maturity" indicated by Financial Benchmark of India Pvt. Ltd. (FBIL).
9. No penalty has been imposed by RBI on the bank during the year.
10. Input Tax Credit and Goods and Service tax payable is subject to reconciliation and consequential adjustments, if any.
11. Previous year figures are re-grouped, rearranged and re-casted wherever considered necessary, to make them comparable with current year figure.
12. Figures are given in "Amount in Rupees".
13. The management has reviewed impact COVID-19 on Deposits, Advances, Assets, Liabilities and profitabilities but no material impact on financial statements except as per RBI guidelines has been observed.  
As the COVID-19 pandemic continued its impact on post balance sheet date could not be ascertained till date of audit.  
The bank has followed RBI guidelines issued with regard to COVID-19.

**For and behalf of Board of Directors.**

**Chairman**  
**(Shri Govindbhai A. Patel)**

**Vice Chairman**  
**(Shri Kanubhai H. Patel)**

**M.D./C.E.O./G.M**  
**(Shri Kamleshkumar J. Shah)**

**For,**  
**M/s Urvish Patel & Co.**  
CHARTERED ACCOUNTANTS  
F.R.N.: - 124710W

**(Urvish Ratilal Patel)**  
**Partner**  
**M. NO. : - 115833**  
**PANEL NO.: - 79**  
**UDIN : -21115833AAAAEH1446**

**PLACE :- Ahmedabad**  
**DATE :- 01/09/2021**

**સભાસદ/ગ્રાહકના હિતમાં જરૂરી**

- ધિરાણ ખાતાઓ પર માસિક વ્યાજના ધોરણે ગણતરી કરવામાં આવે છે. વ્યાજ તેમજ મુદ્દલ સમયસર વસુલ ન આવે તો તેવા કરજદારની ભવિષ્યની શાખને ગંભીર અસર પહોંચે છે.
- જામીન થનાર પ્રત્યેક સભાસદે સમજવું જરૂરી છે કે પોતે કરજદારે લીધેલા કરજની વ્યાજ સહિતની કુલ રકમ તથા કરજ વસુલ કરવા અંગેના યતા તમામ ખર્ચની વસુલાત આપવા માટે જવાબદાર છે, નહિ કે ભાગે પડતી રકમ માટે જ. ભાગે આવતી તમામ રકમ પૂરતા જ તેઓ જવાબદાર છે તે માન્યતા ભૂલ ભરેલી છે. બેન્ક મૂળ કરજદારને છોડીને જામીન પાસે સીધી વસુલાત કરવા હક્કદાર છે,
- આપની થાપણો સમયસર પાડતી મુદતે રીન્યુ કરાવવા સજાગ રહેશો. જેથી વ્યાજના નુકશાનને ટાળી શકાય.
- બેન્કમાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી અનકલેઈમ રહેલ કિપોઝીટ ખાતાઓની રકમ DEAF ફંડમાં મોકલી આપવાની હોય છે. તેથી આ અંગે કિપોઝીટ ખાતાઓમાં આ બાબતનો ખ્યાલ રાખવો.
- કિવિડન્ડ જાહેર થયા તારીખથી કિવિડન્ડની રકમ સભાસદ દ્વારા ત્રણ વર્ષમાં લઈ જવી જરૂરી છે.
- બેન્કના ગ્રાહકો/ખાતેદારોએ તેઓના ખાતામાં છેલ્લા છ માસમાં ઓછામાં ઓછો એક વાર નાણાંકીય વ્યવહાર કરેલ હોવો જોઈએ અને દર છેલ્લાં બે નાણાંકીય વર્ષમાં કે.વાય.સી. રજૂ (અપ-ડેટ) કરાવવાના રહેશે, અન્યથા ગ્રાહક/ખાતેદારના હક્કોને બેન્ક પરત્વેની જવાબદારી ઉપર વિપરીત અસર થયા વગર બેન્ક ગ્રાહકો/ખાતેદારોના હક્કો સ્થગિત કરી શકશે.

**Disclosure of various information as required by the RBI Circular  
No.UBD.CO.BP.PCB.52/12.05.01/2013-14 dated 25/03/2014 is as under: -**

(Rs. In Lakh)

Sr. No.	Particular	As On	
		31/03/2020	31/03/2021
<b>01.</b>	<b>Movement Of CRAR:</b>		
	a) Tier I Capital.	1358.47	<b>1385.76</b>
	b) Tier II Capital.	150.94	<b>221.63</b>
	c) Capital Adequacy Ratio (CRAR) Total.	16.05%	<b>16.81%</b>
<b>02.</b>	<b>Investments:</b>		
	a) Books value of investments.	4648.59	<b>6506.95</b>
	b) Face value of investments.	4672.28	<b>6572.28</b>
	c) Market value of investments.	4999.72	<b>6847.76</b>
<b>03.</b>	<b>Advance against real estate, construction business.</b>	0.00	<b>0.00</b>
<b>04.</b>	<b>Advance against housing.</b>	1247.80	<b>1099.48</b>
<b>05.</b>	<b>Advance against shares &amp; debentures.</b>	0.00	<b>0.00</b>
<b>06.</b>	<b>Advance to directors, their relatives, companies/firms in which they are interested:</b>		
	a) Fund based/Personal Loan.	0.00	<b>0.00</b>
	b) Non-Fund based (Guarantees, L/C etc.).	0.00	<b>0.00</b>
<b>07.</b>	<b>Cost of Deposits:-Average cost of deposits</b>	6.27%	<b>5.74%</b>
<b>08.</b>	<b>NPAs: -</b>		
	a) Gross NPAs.	517.41	<b>345.04</b>
	b) Gross NPAs to Gross Advances %.	5.30%	<b>3.57%</b>
	c) Net NPAs.	0.00	<b>0.00</b>
	d) Net NPAs to Gross Advances %.	0.00%	<b>0.00%</b>
	<b>Movement In NPAs: -</b>		
	a) Gross NPA at the beginning of the year.	289.63	<b>517.41</b>
	Add : Addition during the year.	489.45	<b>750.53</b>
	Less: Reduction during the year.	717.23	<b>578.16</b>
	At the end of the year Gross NPAs.	517.41	<b>345.04</b>
	b) Net NPA at the beginning of the year.	0.00	<b>0.00</b>
	Add : Addition during the year.	0.00	<b>0.00</b>
	Less: Reduction during the year.	0.00	<b>0.00</b>
	At the end of the year Net NPAs	0.00	<b>0.00</b>
<b>09.</b>	<b>Profitability :</b>		
	a) Interest income as a percentage of working funds.	8.17%	<b>7.34%</b>
	b) Non-interest income as a percentage of working funds.	0.07%	<b>0.37%</b>
	c) Operating profit as a percentage of working funds.	1.43%	<b>3.00%</b>
	d) Returns on Assets.	0.85%	<b>1.08%</b>
	e) Business (Deposit + Advances) per employee.	626.22	<b>798.36</b>
	f) Profit per employee.	3.93	<b>6.58</b>
<b>10.</b>	<b>Provision made towards NPAs &amp; depreciation in investments.</b>		
	a) NPAs provision.	276.61	<b>335.81</b>
	b) Required NPAs provision.	132.32	<b>112.16</b>
	c) Investments provision.	102.53	<b>117.16</b>
	d) Standard Assets provision.	52.00	<b>52.00</b>
<b>11.</b>	<b>Movement in provision:</b>		
	a) Towards NPAs.	48.45	<b>59.20</b>
	b) Towards depreciation on investments.	0.48	<b>83.88</b>
	c) Towards standard assets.	0.00	<b>0.0</b>
<b>12.</b>	<b>Foreign currency assets &amp; liabilities: N.A.</b>		
	(i) Assets	0.00	<b>0.00</b>
	(ii) Liabilities	0.00	<b>0.00</b>
<b>13.</b>	<b>Payment of DICGC premium:</b>	18.68	<b>21.64</b>
<b>14.</b>	<b>Penalty impose by RBI</b>	-	-
<b>15.</b>	<b>Restructured Accounts</b>	-	-

**“Financial Security and independence are like a  
Three legged stool resting on savings, insurance and investment”**



# धी माझसा नागरिक सहकारी बँक लि.

बँक प्रगतिना तुलनात्मक आंकडाओ दर्शावजु पत्रक

तारीख	समाप्त संख्या	शेर लंडोन	रीअर्च अने अन्य हुंडो	शापछो	भातानी संख्या	धिराहा	भाता नी संख्या	कामडाजु लंडोन	नई	डिविडन्स %
31/03/2002	5442	2,84,00,700	6,12,94,155	41,51,48,862	43512	25,62,82,752	3094	63,19,62,847	75,00,000	12.00
31/03/2003	5594	2,92,88,175	6,53,42,942	36,88,46,531	38933	19,85,33,211	2890	56,73,58,933	71,51,000	12.00
31/03/2004	5747	2,90,32,550	6,95,63,489	37,63,96,355	35009	18,77,49,495	2750	59,01,22,340	70,00,000	10.00
31/03/2005	5808	2,84,98,025	7,33,24,482	37,17,65,297	33727	18,68,24,642	2466	58,21,08,329	11,07,419	5.50
31/03/2006	5889	2,92,32,975	7,29,10,007	35,16,94,313	31352	20,53,51,325	2244	53,11,43,601	21,50,137	6.00
31/03/2007	5948	3,01,70,025	7,43,03,945	38,65,80,743	31124	24,84,59,105	2220	55,32,36,798	36,64,925	9.00
31/03/2008	6220	3,27,34,375	7,53,26,989	46,57,29,850	34620	28,11,65,888	2260	62,30,92,976	35,92,926	8.00
31/03/2009	6422	3,40,82,800	8,10,75,603	51,63,33,569	35254	28,81,33,048	2049	68,14,50,764	36,25,289	8.00
31/03/2010	6740	3,63,24,975	8,86,52,221	60,89,88,773	36865	37,16,97,853	2135	79,45,75,719	41,00,430	8.00
31/03/2011	6798	3,86,67,325	14,33,49,610	63,83,44,182	37040	38,25,34,486	2080	88,36,61,606	1,35,96,097	-
31/03/2012	6867	4,13,00,300	17,58,83,445	70,28,08,126	36750	45,15,48,238	1879	1,01,44,70,966	1,15,39,891	-
31/03/2013	6910	4,29,71,600	17,65,85,345	75,64,24,862	36580	50,70,88,131	1716	1,04,15,75,281	2,36,51,662	-
31/03/2014	6955	4,57,81,350	17,41,54,058	88,27,50,720	41452	54,07,37,267	1793	1,19,64,03,995	1,21,27,349	12.00
31/03/2015	6969	4,92,27,650	17,41,82,729	1,04,35,06,338	41738	68,57,04,476	1779	1,37,17,31,650	1,20,67,978	15.00
31/03/2016	6902	5,15,78,650	17,62,15,642	1,23,64,42,470	36650	71,12,71,666	1681	1,49,05,92,877	1,16,77,833	12.00
31/03/2017	6937	5,37,35,550	17,88,61,456	1,49,60,10,067	38163	71,28,90,517	1432	1,79,29,36,616	1,21,56,500	15.00
31/03/2018	7007	5,71,37,050	18,87,84,899	1,54,24,04,691	38385	79,35,99,927	1433	1,84,16,97,780	1,27,00,000	12.00
31/03/2019	7032	6,10,35,400	19,93,96,032	1,54,52,68,779	37603	95,22,90,688	1327	1,89,35,91,494	1,41,75,000	12.00
31/03/2020	7023	6,31,29,250	20,89,08,206	1,65,45,37,364	37414	97,55,94,984	1320	1,94,57,30,370	1,65,00,000	0.00 (Due to Covid-19)
<b>31/03/2021</b>	<b>6980</b>	<b>6,52,75,025</b>	<b>22,25,08,386</b>	<b>19,06,457,550</b>	<b>37654</b>	<b>96,76,30,417</b>	<b>1288</b>	<b>2,203,787,983</b>	<b>2,37,00,000</b>	<b>12.00 सूचित</b>



# આપની સુરક્ષા એજ અમારી મનોકામના




પ્રોપર માસ્ક પહેરો



સ્વચ્છતા રાખો



પ્રોપર હેન્ડ વોશ કરો



અન્યથી  
અંતર રાખો



કોરોનાના લક્ષણો દરમ્યાન  
ચેક-અપ અવશ્ય કરાવો



ઘરે રહો  
જ્યારે તમે બીમાર છો

સલાસદ નં. : \_\_\_\_\_

BOOK-POST

TO, \_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_

**વિના સહકાર નહિ ઉદ્ધાર**



**ધી માણસા નાગરિક સહકારી બેંક લિ.**

મુ. માર્કેટ ચાર્ડ, માણસા-૩૮૨૮૪૫, જિ. ગાંધીનગર, (ઉત્તર ગુજરાત).

ફોન : (૦૨૭૬૩) ૨૭૦૩૦૪, ૨૭૦૭૩૬, ૨૭૪૩૫૮, ફેક્સ : ૨૭૦૪૦૩